

શ્રી અશોમિયાલિ
શ્રી નંદમાળા

4398

દાદાસાહેબ, પાલનગર,
દાદાસાહેબ, પાલનગર.
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૧૮૨૬

પ્રકાશ " ની ૨૦૧૫/૧૬ ની લેખ

૫

Yashovallav Jain Granthmala

શ્રી નંદ જ્યોતિસ્થ



પ્રદમ પત્રિત ગ્યારિયાજ શ્રી નંદ જ્યો

[મદ્દાય આડ આના]

“શ્રી જેન ધર્મ પ્રકાશ” ની સા. ૨૦૧૫-૨૦૧૬ ની લેટ

શ્રી નૂતન રાત્રંજ્યોક્ષાર

તથા

મહાતીર્થને લગતો ઉપયોગી સંચાલ

કુ
પ્રકાશક

શ્રી જેન ધર્મ પ્રસારણ સભા
આવનગર

કુ
રચિયિતા

શ્રી બાતચંદ હીરાચંદ “સાહિત્યચંદ”
માનુષાંવ

કુ
આર્થિક સહાયકો

શ્રી કર્મચંદ બાતચંદ-કલકત્તા
શા. રસિકલાલ બાતચંદ મહેતા-માલેગાંવ

પા. સા. ૨૦૧૫

વિ. સા. ૨૦૧૫

ફ. સા. ૧૯૫૮

મૂલ્ય આડ આના.

સાચિન પ્રેસ :: બાતચંદ

પ્રકાશકનું નિવેદન

દિવસે દિવસે મોખવારી વધતી આવે છે અને “શ્રી જૈન ધર્મ પ્રકાશ”ને કારા પ્રમાણુમાં મોટ સહૃદ કરવી પડે છે, તાં પણ “પ્રકાશ”ના આલોને અને શ્રી જૈનધર્મપ્રસારક સભાના સભ્યશંખ-ઓને બેટ પુસ્તક આપવાનો શિરસ્તો અખાંજિ રીતે ચાલુ રાખવામાં આવ્યો છે, જે ખરેખર તો તેના સહાયક અંધુઓને જ આભારી છે.

છેલ્લા કેટલાએક વર્ષોથી એક પછી એક ડપયોગા બેટ પુસ્તકો આપવાથી લોકોનો ચાહ વધતો આવે છે અને કેટલાક સભાસદ-અંધુઓના પ્રશાસન-પત્રો પણ મળે છે. આ વર્ષને સં. ૨૦૧૫-૧૬ ના વર્પું મારે જાણ્યુના કેબદ્ધ, શાશ્વત કવિ અને તત્ત્વવિનિતક શ્રી બાલચંદ્રાઈ હૃદાચંદ્ર “સાહિત્યચંદ્ર”ની નવીન કુનિ “નૂતન શરૂંજ્યોદ્ધાર” પસંદ કરવામાં આવી છે. તેની પ્રથમ આવ્યું શેઠશ્રી કીસનદાસ ભૂખાણદાસની આર્થિક સહાયથી વિ. સં. ૧૯૬૭ માં અધાર પડેલ, જે જનતામાં સારો આદર પામી હતી, તેની નકલ મળતી ન હતી એટલે કલકનાનિવાસી અને આપણી સભાના સભાસદ તેમજ થુબેચુંછક શ્રી કર્મચંદ લાલચંદ્રાઈને તે સંબંધી પ્રેરણા કરતાં તેમણે રી. ૩૦૦) પ્રણસો તથા કેંપકશીની પ્રેરણાથી શા. રસિકલાલ બાલચંદ મહેતાએ રી. ૧૦૦) આર્થિક સહાય આપવાનું કબૂલ કરતાં અમે આ કુનિ પ્રકાશિત કરી શક્યા છાયે. શ્રી કર્મચંદ્રાઈ ગુણ સાધારણોમાં વિશેષ માને છે; કુર્તિથી ખર રહુ છે અને ધ્યાભિક કાર્યોમાં સુકૃતની કમાણુના સદ્ગ્યય કરતાજ રહુ છે, જે ખરેખર અનુમોદનીય અને આચરણીય છે. તેમના રવર્ગસ્થ પલી માણુકબાઈના ક્રીયાર્થે આ પુસ્તક પ્રકાશન કરાયેલ છે.

શ્રી આલયંદ્ભાઈ સભાના પરમાદિતસ્વા હે. શ્રી જૈન ધર્મ પ્રકાશનો એક પણ અંક ગેવો નહિં હાય જેમાં તેઓથાતો પદ કે ગદ્ય કેખ નહીં હાય. શ્રી આલયંદ્ભાઈની આ દૂંઠ માટે વળાણું કરેયાને સુવિષ્ણુને ઓપ ચદ્દાવવા જેવું છે. તેમણે પ્રાચીન અંથો પરથી અર્વાચીન પદ્ધતિએ શ્રી શરૂંજયના થયેલા ડ્રાગેને હળવી ભાવામાં ચૂંથી લાઘાં છે આ પુસ્તિકાને વિશેષ ઉપયોગી અનાવવા માટે આપણું સભાના સેણેરી શ્રી દીપચંદ લુલાલાલ શાહે પણિશમપૂર્વક તૈયાર કરેલ તીર્થાધિનજ શરૂંજયનું સંક્ષિપ્ત વર્ણનનો સમાવેશ કરેચામાં આવ્યો છે. તેઓશાશ્વે તીર્થને લગતી સમય માફિતી સંક્ષિપ્તમાં જનાં મુદ્દાસર આપો છે, જે તીર્થપ્રેમાને માટે ઉપયોગી છે. તહૃપરાંત આ પુસ્તકને વિશેષ ઉપયોગી અનાવવા પ્રાચીન ચૈત્યવંદનો અને સ્તવનો વિગેરનો સમાવેશ કર્યો છે.

શ્રી કરમચંદ્ભાઈ જ્ઞાન-પ્રચારના આવા કાર્યોમાં વિશેષ સહાયતા કરતા રહે અને શ્રી આલયંદ્ભાઈ પોતાની સુકૃતમનો પ્રસાદ જનતાને અરજો આપ્યો જ કરે એમ ઘણ્ણીએ છીએ.

શ્રી જૈન ધર્મપ્રસારક સભા

સં. ૨૦૧૫: અક્ષય તૃતીયા

સાચનગર.



* આત્મનિવેહન *

મારા લાણેજ શોં કીસનહાનું ભૂખણુંદાસે શ્રી શનું-
જય તીર્થના જુદ્ધ જુદ્ધ ફોટોઓ લેવરાવી, તેને એન.
લાર્ન કરાવી, તેમાં રંગ પૂરી આરીસાઓ બનાવી
માલેગામના જિનમંહિરમાં “શ્રી શનુંજયપ્રાસાદ”
તર્ફથી પધરાવેલ છે. તેઓએ નૃતન પદ્ધતિને અનુ-
સર્વ ડાયરચના કરવા મને જણાવું અને તે મારે
નેક્ટના પુસ્તકો મને સોંચા. તે મુજબ “શ્રી નૃતન
શનુંજયોદ્ધાર” નામક ડાયર મેં રચી આગું. તેઓએ
પોતાના અર્થે અંબત ૧૯૬૪ માં તેની પ્રથમ આવૃત્તિ
પ્રગટ કરી. તેની પ્રતો હાલમાં અલાનું થઈ ગયું છે.
ત્યારે તે પુસ્તકમાં કેટલોએક સુધારોવધારો કરી
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને મેં સોંપેલ. આ પુસ્તકની
જીબું આવૃત્તિ પ્રગટ થતી જેઈ મને ધણે આનંદ
થાય છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ તેમાં કેટલી-
એક નર્વી માહિતી ઉમેરી પુસ્તકની ઉપયુક્તતા વધારી
છે તે મારે સભાનો હું ઉપકાર માનું છું.

માલેગાવ :

સાહિત્યચંડ આલચંડ હીરાચંડ

સ્વ. માણેકભાઈ કરમચંહ શાહ



જન્મ : લુધી (૩૨૭) ૨૬ મી સેપ્ટેમ્બર ૧૯૬૨

સ્વર્ગવાસ : કલકતા ૨૧ સેપ્ટેમ્બર ૧૯૫૬

૪૩૦ માણેકભાઈ કરમચંહ શાલે

કુશના પાઠનગર બુજ્ઝમાં તેમનો રહ મી જરૂરે જરૂર
૧૯૬૨ ના રોજ જન્મ થયેલો. “માણેક” જેવા
કાન્તિવાળા હોવાથી તેમનું માણેકભાઈ એવું યથાર્થ
નામ પાડવામાં આવ્યું. બાળવયમાં ઉચિત જાંસ્કાર
લઈ નેચો સુશીલ અને અદૃગુણી એપ્રિલવર્ષે શ્રી કરમ-
ચંહ લાલચંહલાઈ સાથે લગ્નથંથીથી જોડાયા.

સરક સ્વલાવી અને સૌભ્ય સુખમુદ્રાને કાંરણે તેઓ
સર્વના પ્રીતિપાત્ર બની ગયા. કુશળ ગૃહિણી તરીકે
ગૃહ-જાંસ્કાર ચલાવી શસ્ત્ર પક્ષમાં સર્વ કોઈની ચાહના
પ્રાપ્ત કરી લીધી.

ધર્મના જાંસ્કાર ગગધૂરીમાંથી જ હોવાથી નિત્ય-
કર્મ કરી પણ ચૂકતા નહિ. અફાઈ અને વર્ષીતપ
જેવી તપશ્ચર્યા કરી સ્વજીવનનું સાક્ષ્ય કરેલું અને
તે શુલ્પ પ્રમંગને અનુલક્ષીને સુકૃતની લક્ષ્મીનો મારા
પ્રમાણુમાં અદ્વિત્ય કર્યો. દરેક માસે અપ્રમી-ચતુર્દશી-
નો ઉપવાસ કરતા. ધણુ વર્ષોથી ગરમ ઉકાળેલું પાણી
હુમેશા ગીતા અને ચોવિહાર પણ કરતા. કલકત્તામાં
તેઓશ્રીની ધર્મકરણીની સૌ કોઈ પ્રશંસા કરતું.

ચોન્હ વર્ષની વય થવા છતાં તેમની ધર્મશ્રદ્ધ
પાણી જ હંડ હતી. ૨૧ મી જરૂરે જરૂર ૧૯૭૫ ના રોજ
તેઓ સ્વર્ગવાસ્ત પાણ્યા તે હિવસે વહેલા જોડી પ્રથમ
પ્રતિકમણુ કરી લીધું. તે હિવસે જિનાલયમાં શાન્તિ-
સ્નાન જેવો મંગળકારી પ્રમંગ હોવાથી મોટર દુઃધિવરને

આડ આત કદાકે મોટર તૈયાર રાખવાની સૂચના આવી,
પોતે જામાયિકમાં એડા. આમાયિક પૂર્ણ થવાના અમૃતે
કેટલા વાગ્યા છે, તે જેવા મારે, બાળુના રૂમમાં,
બદવળો તથા મુહૂરતિ લઈને ગયા. ઘડીયાળમાં જેતાં
જ કંઈક બદ્ધર આવવા લાગ્યા એટલે પોતે જર્મીન
પર એજી ગયા અને તત્કષ્ણ જ મુર્ચિષ્ઠત અની ગયા.

અચાનક આવી ઘરના બનતાં અર્વી કુટુંણીજનો
એકન થઈ ગયા અને ડોકટરને ઓલાવ્યા મસ્તક પર
શીતળ જગાનો છાંટકાવ કરી, મુખમાં પાણી પાવાની
કાળે તરતજ પોતે ઓલાવ્યા કે “આજે મારે પોરાણીનું
પદ્ધતિપાણું છે. મને પાણી ન પાડો” આરદું ઓલીને
પાછા એભાન થઈ ગયા.

ડોકટરે આવી તપાસતાં હાઈ-એરોક માલૂમ પડ્યો.
દુંજેકષણ આપવાની તૈયારી કરતાં જ અહૃગુણી ને
સરવાદિવશીલ માણેકણાનો આતમા સ્વર્ગને પંચે
અંગર્યો.

ધાર્મિક વૈશ્યામાં મૃત્યુ પામવું એ યણુ જિંદગીનો
આણુમણો લક્ષાવો કે અને પરલવમાં અહૃગતિ પ્રાપ્ત
થવાનું સૂચન છે.

સ્વલાવે શાંત, પ્રકૃતિએ ભર, હનમુળા ને મિલન-
આર પુણ્યવાન આત્માને જ આવું મૃત્યુ પ્રાપ્ત થાય.

શ્રી કરમચંહલાઇએ સ્વર્ગસ્થના એચાથે લક્ષ્મીનો
છુટે હાથે અહૃવ્યય કર્યો.

नूतन

श्रीनृग्नयोद्धार

श्रीशत्रुंजयस्तोत्रम् ।

(उपजातिशत्रम्)

शत्रुंजयो नाम नगाधिराजः, सौराप्तदेशे प्रथितप्रशस्तिः ।
 तीर्थाधिराजो भुवि पुष्यभूमस्तत्रादिनाथं शिरसा नमामि ॥१॥

अनंततीर्थाधिपसाधुवृन्दैर्या सेविता शांतिपाभिवृद्ध्यै ।
 सा पुष्यभूमिर्वितनोतु सौख्यं, जिनादिनाथं शिरसा नमामि ॥२॥

अनेकराज्याधिपमन्त्रिमुख्यर्विनिमिता सुंदरचैत्यपंकिः ।
 स्वर्मूमितुल्या भुवि सुप्रसिद्धा, तत्रादिनाथं शिरसा नमामि ॥३॥

विश्रामधामो मुनिसाधकानां, संसारतपैर्हतसाधकानाम् ।
 ये यानतुल्यो भवजालमर्गे, जिनादिनाथं शिरसा नमामि ॥४॥

या पादपद्मैः पुनिता सुभूमिरनंतयोगीमुनिभिर्नितान्तम् ।
 आकर्षणं सुम्बकरलतुल्यं, तत्रादिनाथं शिरसा नमामि ॥५॥

निसर्गरस्योदितनाकलतुल्या, गिरीन्द्रसौगन्धितवृक्षराजिः ।
 विचित्रवर्णैः सुमनोहरा च, तत्रादिनाथं शिरसा नमामि ॥६॥

शत्रीद्रदेवैः परिवेष्टिताश्च, नृत्यन्ति शूंगारभूताः सुभक्तया ।
 कुर्वन्ति वृष्टिं मधुगन्धपुष्पैस्तत्रादिनाथं शिरसा नमामि ॥७॥

स्वजीवितं पावनतामुपैति, ये पूजयन्ति प्रभुपावयुग्मम् ।
 श्रीनाभिपुन्नं प्रथमं जिनेन्द्रं, युगादिनाथं शिरसा नमामि ॥८॥

૧. મંગલાચરણ

* દુષ્ટા * *

વીણા પુરુષકંધારિણી, પ્રખુમું શારદ માત;
 જસ ચરણાંયુજ સેવતા, પ્રતિલા હો સાક્ષાત. ૧
 તીર્થરાજ સિદ્ધાચલે, પ્રખુમું આદિજિતુંદ;
 જન્મ સફલતા હું વરું, વલ્લુંવતા જિતયંદ. ૨

૬૩ ૧ લી (દેશી-ચોરી ર્ઘના કરી રહી ચોકમાં)

ગિરિ સિદ્ધાચલ ગુણુ ગપાઈએ,
 ધરી આદિ જિનેધર ધ્યાન, મૂકી અભિમ્બન,
 સિદ્ધાચલ વંદીએ (આંકડી)

ગિરિ શાખત છે ત્રણ કાળમાં,
 એહ સુક્રિતાણું છે દાતાર, લુયોનો આધાર, સિ. ૧
 થયા સિદ્ધ અનંત સુનિ ઈહાં,
 કેદ તીર્થંકર જગદીશ, અનંત સૂરીશ, સિ. ૨
 શુલ લાવતણી શ્રેણી ઈહાં,
 થઈ લક્ષ્ણ વિવિધ જે સ્વરૂપ, ચિદાનંદરૂપ, સિ. ૩
 ગયા કેવલિ હેવ વિષુધ ઘણું,
 વર્યા સુક્રિતનગરીનો વાસ, અખંડ નિવાસ, સિ. ૪
 જેહ લબ્ધ કૃત્સે એહ તીર્થને,
 તસ સંસારનો થાય અંત, વરે તે અનંત, સિ. ૫

શ્રી આદિ જિનેશ્વર કેવળી,
 પૂછે પુંડરીક ગણુધાર, શાસ્ત્રનો વિચાર, સિ. ૬
 એહ તીર્થ અનાહિઅનંત છે,
 થયા થાશો અનંત ઉદ્ધાર, નિશ્ચય મન ધાર, સિ. ૭
 જગમાણે એ તીર્થ છે શાશ્વતું,
 થયું અનંત ચોવીશીનું ધામ, વિમલ અલિરામ, સિ. ૮
 ઇહાં આવશો લાવી તીર્થંકરે,
 ત્રણ કાલ રહે એ અખંડ, મહિમા છે પ્રચંડ, સિ. ૯
 એંશી ચોજન ને પ્રથમારકે,
 થયો સિતેર દ્વિતીયમાં જેહ, નમો ધરી નેહ, સિ. ૧૦
 થયો સાઠ ચોજન ત્રીજ આરકે,
 ચોથે અર્ધ શતક જેહ હોય, નાવે તુલ્ય કોય, સિ. ૧૧
 પાંચમે ખાર ચોજન લાભિયો,
 છઠે સાત હાથનું પ્રમાણુ, શાસ્ત્રમાણી જાણુ, સિ. ૧૨
 સ્થિર નામ ને ઢામ છે જેહનું,
 નહિ તોડે પ્રલય પણ જેહ, નમો તીર્થ તેહ, સિ. ૧૩
 એવા તીર્થ જિરિને ગાઈશું,
 દેહ શાસ્ત્રણ્ણો આધાર, ગાઈશું ઉદ્ધાર, સિ. ૧૪
 જગમાણે ન તીરથ એહલું,
 વહે ખાલેન્દુ લક્ષ્ણ રસાળ, ધરીને વિશાલ, સિ. ૧૫

૨. ઉદ્ધારવણીન

* હૃદા *

તીર્થાઙ્કરણે પુણ્ય છે, લબ્ધનિસ્તારણું મંત્ર;
અમણું મટે લબ્ધવન વિષે, આત્મોદ્ધારણું તંત્ર. ૧

દાળ ખીજુ (દેશી-આવો આવો જસોદાના કંથ)

જય જય એલો ગિરિરાજ, સિદ્ધગિરિ લેટો રે,
કેદ કોડ લબાંતર પાપ, ક્ષણુમાં મેટો રે. (આંકણી)

ઓહ તીર્થતણું ઉદ્ધાર, વિવિધ કરાવે રે,
કરી સેવાલક્ષ્મિ અહુ ભાવ, પાપ હરાવે રે. જય-૧

કરી તીર્થતણું ઉદ્ધાર, આત્મોદ્ધાર રે,
મુક્તિનગરીનો નિવાસ, મેળવે સાર રે. જય-૨

શ્રી ઋષલજિનંદ ઉપદેશ, પ્રથમ કરાવે રે,
ચક્રવર્તી ભરત ઉદ્ધાર, અનુપમ ભાવે રે. જય-૩

આઠમો નૃપ ભરતનો વંશ, ધર્મ દિપાવે રે,
દંડવીર્ય નૃપતિ ઉદ્ધાર, ખીણે કરાવે રે. જય-૪

પ્રભુ સીમંધર ઉપદેશ, ઈદ્રને ભાવે રે,
કરે ઈશાનેંદ્ર ઉદ્ધાર, મુગતિ સુખ પાવે રે. જય-૫

કરે ચાયો ઉદ્ધાર મહેંદ્ર, દેવનો સ્વામી રે,
પુણ્ય પુંજ અખંડ મિલાય, સદ્ગતિગામી રે. જય-૬

અંદેંદ્ર કરે ઉદ્ધાર, પંચમ વાર રે,
દેવલોકથી આવી ગિરિંદ, જન્મનો સાર રે. જય-૭

જે ભુવનપતિ ચમરેંદ્ર, લાવના જાગી રે,
છહું કરતા ઉધાર, ધર્મના રાગી રે. જ્ય-૮
ચક્રવર્તી ભરત પછી જાણુ, સગર તે ખીને રે,
જાગી ભાગ્યદશા મનમાંહે, અંતર રીતો રે. જ્ય-૯
પ્રભુ ભણિભય બિંખ વિશાળ, કાલ પિછાણી રે,
કરે સ્થાપિત ગુસ લાંડાર, ટાળવા હાનિ રે. જ્ય-૧૦
કરે કનકતણું જિન બિંખ, હું ધણેરો રે,
કરી સાતમો તીર્થાધાર, જિનવર પ્રભુનો રે. જ્ય-૧૧
વ્યંતરેંદ્રનો આઠમો જાણુ, શુલ ઉધાર રે,
પ્રભુભક્તિતણો એ સાર, ધર્મ આધાર રે. જ્ય-૧૨
શ્રી ચંદ્રપ્રભુ ઉપદેશ, લાવના જાગી રે,
નૃપ ચંદ્રજસા મનમાંહે, પ્રભુ ૨૬ લાગી રે. જ્ય-૧૩
કર્યો નવમો તીર્થાધાર, સિદ્ધગિરિ આવી રે,
મન લાવ અપૂર્વ ઉલ્લાસ, લાવના લાવી રે. જ્ય-૧૪
પ્રભુ શાંતિનાથ ઉપદેશ, ચકાયુધનો રે,
થયો દથમો તીર્થાધાર, મનહર ગિરિનો રે. જ્ય-૧૫
શ્રી મુનિસુસુત જિનરાજ, તીર્થમાં થાવે રે,
રામચંદ્રતણું ઉધાર, સહુને લાવે રે. જ્ય-૧૬
દથરથસુત ભક્તિ સહિત, સિદ્ધગિરિ આવે રે,
કરે અભ્યારમો ઉધાર, મનને લાવે રે. જ્ય-૧૭

પ્રભુ નેમિજિનેશ્વરરાજ, પાંડવ આવે રે,
 કરે ખારમો તીર્થોધાર, સુંદર લાવે રે. જ્ય-૧૮
 મુનિ વળજીષિ ઉપદેશ, ઉધાર તેરમો રે,
 જવડશા* અછિ સુભાણુ, સજજન મન રમો રે. જ્ય-૧૯
 સંવત એકસો ને આડ, ગિરિવર આંદ્રા રે,
 કરે ઉધાર કાર્ય અનુભ, સહુ મન લાંદ્રા રે. જ્ય-૨૦
 નૃપરાજ શિલાદિત્ય+ જેહ, વલલભીનગરે રે,
 મલલરાજ સૂરિ ઉપદેશ, લાવના ધારે રે. જ્ય-૨૧
 સધ્યમ્ પમાઝ્યો તેહ, લક્તા અનાંદ્રો રે,
 ઉધાર કરાંદ્રો સાર, સહુ મન લાંદ્રો રે. જ્ય-૨૨
 સંવત ખાર તેરમાં જાણુ, તીર્થોધાર રે,
 કરે ખાહડ મંત્રી^x વિખ્યાત, ચૌદમી વાર રે. જ્ય-૨૩

* જવડશા અઙ્ગાનિસ્તાનમાં વેપાર કરતા હતા. તાં મુનિ-
 સમુદ્ધાય અથો હતો, અને જવડશાને ઉપદેશ કરી શ્રી શત્રુંજયના
 ઉદ્ઘારની પ્રેરણું તેમણે કરી હતી. તીર્થના મંહિરનો કલશ ચઢાવતા
 જવડશા અને તેમના પત્નીને અત્યાનંદ થયો. ભાનજવાથી અકુરાત
 થયો, અને બને પતિપત્ની તેજ જ્યાએ સ્વર્ગરથ થયાં.

+ મહારાજ શિલાદિત્યના શ્રી મલ્લવાદિસ્થરિ ભાણેજ હતા.
 તેમના તેજરવી ઉપદેશથી રાજએ બુદ્ધ ધર્મ છોડી જૈન ધર્મ
 રવીકારી સં. ૪૭૭માં તીર્થોધાર કર્યો.

x ઉદ્યાન મંત્રી. તીર્થદર્શનને ગયા ત્યારે એક છદરે સણગતી
 વાટ લઈ ખાલમાં પ્રવેશ કર્યો. તે નિહાળી આરાતનાનું કારણું જોઈ
 લાડેનાનું કામ કાઢી નાખી, પાખાણુભય. મંહિર બંધાવવાની પ્રતિરા

હેમચંદ્રસૂરિ ઉપદેશ, મનમાં વસીએ રે,
 કરે તીર્થસેવા બહુ લાવ, મુક્તિને રસિયો રે. જ્ય-૨૪
 સમરાશા* જે ઓશવાળ, તીર્થના રાગી રે,
 કરે પંદરમો ઉધાર, લાવના બણી રે. જ્ય-૨૫
 અકોતર તેરસે માહે, ઉધાર કીધો રે,
 કરી સેવાલક્ષિત બહુ લાવ, બહુ જશ લીધો રે. જ્ય-૨૬
 સત્યાશી પંદરશે સાલ, ઉધાર સોળમો રે,
 કરમાશા+ આવક રાજ, કરતો તે સમે રે. જ્ય-૨૭
 આગામી કાળમાં જાણુ, ઉધાર કરશે રે,
 તેહ વિમલવાહન ભૂપાલ, લવજલ તરશે રે. જ્ય-૨૮
 તીરથ ઉધારથી જાણુ, લવજલ તરશે રે,
 ખાલેનું કહે તે સુભાણુ, મુક્તિને વરશે રે. જ્ય-૨૯

કરી ઉધયનમંત્રીએ આકરા નિયમો લીધા. હૈવયોગે યુદ્ધમાં તે ભૂત્યુ પામ્યા
 પછી તેમના સુપુત્ર શ્રી કુમારપાળ મહારાજના મંત્રી બાહ્યડે પિતાની
 ઇજી પૂર્ણ કરતાં તીર્થને: ઉધાર કર્યો. નૂતન મંહિર સંવન ૧૨૧૪માં
 પૂર્ણ કરી અતિષ્ઠા કરી. એ જ મંહિર હાલમાં વિધમાન છે

* અલ્લાઉદ્દીનના વખતમાં સભરાશા તિલંગ દેશના સુઅદ્ધાર હતા. દિલ્હીમાં વસતા હતા. જાદ્શાહની સલાહ અને મહદે મેળવી તેમણે તીર્થઉધાર કર્યો હતો.

+ કરમાશા ચિતોડમાં રાજકાર્યધુરંધર તરીકે પ્રસિદ્ધ થયા હતા. અમદાવાદનો નાનો શાહજાહે એમના આશ્રયે રહ્યો હતો. એ ગાઢી ઉપર આવતાં તેની મહાથી કરમાશાએ તીર્થઉધાર કર્યો. સંવત ૧૫૮૭ વૈશાખ વદ ૬. એ વખતે અનેક ગંધીના આચાર્યાએ ખૂલ મંહિર બધા ગંધો માટે સરળું માન્ય અને પૂજ્ય હરાવેલ છે.

૩. પાલીતાણા દર્શન

* દુષ્ટા *

પાલીતાણા નગરનો, તીર્થચરણમાં વાસ;
ભક્તિગંધ મહાકે જિહાં, આપે નિત્ય સુવાસ.

ઢાળ ત્રીજી (સુણુ ગોવાલણી ગોરસ્સાવાલી)

એ સિદ્ધગિરિ સોરઠ ભૂષણ, લવલયભંજન તીર્થ છે;
જે ભારતમાં જગતારણ, અકલંક અલૌકિક તીર્થ છે—આંકણી
જે ગિરિવર રજરજ પૂનિત છે, મુનિતીર્થપતી સ્પર્શિત સહુ છે;
જે એકવીસ નામે વંદિત છે, નવાણું નામાંકિત પણ છે.

એ સિ. ૧

જ્યાં પાદલિમસૂરિના નામે, નાગાઙ્ખુંન શિષ્યે બહુમાને;
પાલીતાણા પુર નિર્માણું, ગુરુદમરણ અખંડિત તિહાં લાયું.

એ સિ. ૨

જે ધર્મસ્થાન વિભૂષિત છે, જિનમંદિર મંડિત શોલિત છે;
સાહિત્ય પાઠશાળા જ્યાં છે, આગમમંદિર સુંદર ત્યાં છે.

એ સિ. ૩

મંદિર દરા પુરમાં શોલે છે, પ્રાસાદ ધર્મશાળા જ્યાં છે;
ચાલીસ વિશાળ બિરાજે છે, આરોગ્યાલય પણ દીપે છે.

એ સિ. ૪

શ્રી યશોવિજય ગુડુકુલ જ્યાં છે, મુનિગણુલણુતા બહુ દીસે છે;
શાખાબ્દ્યાસે રત સહુ જણુ છે, પાઠક શિષ્યે તે ભૂષિત છે.

એ સિ. ૫

લ્યાંશી શાનુંજ્ય દીસે છે, મંદિર નગરી સમ ભાસે છે;
અંકિત અરણ્યાં જયાં ખાડું વહે છે, જ્ય જ્ય મુખ્યથી જયાં નીકળે છે.

એ સિ. ૬

ધનધાન્ય પણે ઘૃતથી પૂરું, જે ભૂમિ રસાળથકી સારુ;
છે પુર પાદીતાણ્યા ઘ્યારું, જે પુણ્યભૂમિ છે ભવતારુ.

એ સિ. ૭

સંસારતાપથી જે તપતા, પાપી નિર્દ્ય જસ નહિ ભમતા;
એવા પણું એ ગિરિને ઘ્યાવે, સહેજે મુક્તિપદ તે પાવે.

એ સિ. ૮

સહુને વિશ્રામ સુલલ જયાં છે, વિદ્ધા ભણુતા મુનિ શ્રાવક એ;
આણાર સુલલ સુખકર ત્યાં છે, જયાં પંડિત ને ભવિ પાઠક છે.

એ સિ. ૯

મન નિર્વિકાર સહેજે થાવે, શાંતિ આત્માની અગટાવે;
કુંડો શીતલ જલથી ભરિયા, વનરાજ વનસ્પતિ હુઃઅ હરિયા.

એ સિ. ૧૦

આ દેવનગર ગિરિશૂંગોમાં, દેવેન્દ્રે વસ્ત્રાચ્યું આ જગમાં;
ભાસે છે સ્વર્ગ જ અવનીમાં, વિશ્રામ મુક્તિના મારોમાં.

એ સિ. ૧૧

તપતપતા ગિરિની છાયામાં, જે વન્ય શુદ્ધમાં ગિરિવરમાં;
કેદ શાંતિ વર્યા નિજ આતમમાં, હશેંક થધ માર્ગ જિનેન્દ્રોના.

એ સિ. ૧૨

સિદ્ધાચલ જેન હૃદય વસિયો, યાત્રા નિત કરતો મન રસિયો;
હુલ્લાંગ ન જે નજરે દેખે, તસ જન્મ ન છે લાગ્યો કેખે.

એ સિ. ૧૩

જ્યાં ચિત્ત પ્રફુલ્લિત બહુ થાવે, ગિરિવરના ગુણ સહુ મળી ગાવે,
પ્રતિપદમાં આતમ વિકસાવે, ભાલેન્દુ જેના ગુણ ગાવે.

એ સિ. ૧૪

૪. સિદ્ધાચલદર્શન

* દૃષ્ટા *

ગિરિવર જગમાં બહુ રહ્યા, દીસે બહુ ઉતુંગ;
પણ એ ગિરિસમ નહીં દિસે, અન્ય કોઈ મન ચંગ. ૧
એ સુરગિરિથી પણ વડો, જેતાં મન આનંદ;
ભવિજન હેર્દ દર્શને, ધરતા દ્વરાનંદ. ૨

ધાર ચોથી (દેશી-મનમંહિર આવે રે, કહું એક વાતલડી)

સિદ્ધ ગિરિવર જઈને રૈ, આદીશર વંદો,
સહુ ચાલો ઉમંગો રૈ, જેથી ચિર નંદો-આંકણી

પહેલી લાથા તળેટી રૈ, સહુને શાંતિ કરે,
માતા ગંગાંખાઈનું રૈ, સ્મારક ચિત્ત હુરે. સિ. ૧

લાલલાઈ સુપુત્રે રૈ, નિર્માયું લાવે,
ધર્મધામ કરાવ્યું રૈ, સહુના મન લાવે. સિ. ૨

લાઘું નાહર કુલથી રૈ, પ્રારંભ જ્યાં થાવે,
પુષ્ય ખાંધ્યું અખંડ રૈ, ગતિ શુલ કે લાવે. સિ. ૩

પણી આગમમંદિર રે, દર્શન ત્યાં કરીએ,
જિનવાણી અખંડિત રે, સ્થિર થઈ નિરખીએ. સિ. ૪

કલિકાલ ચમત્કૃતિ એ, આણું હસાગરની,
બહુ કાલ એ થાશે રે, શાંતિ ભવિક જનની. સિ. ૫

પિસ્તાળીસ આગમ રે, દેહરીએ નિરભી,
પ્રભુ વીરની વાણી રે, અમર મુગતિકાભી. સિ. ૬

વીર પુત્ર પ્રભાવી રે, સાગર જીનતણો,
ઉદ્ધાર આગમનો રે, સહુ કોઈ શાસ્ત્રી લણો. સિ. ૭

આવી વિજય તળેટી રે, મુક્તિ તણી ખારી,
ભવિ જીવના મનમાં રે, લાગે જે સારી. - સિ. ૮

આદિજન પગલાં રે, ખીજ શાંતિ ભલા,
દેરીએ ત્યાં શોલે રે, ખાવીસ શુલ્ષ પગલા. સિ. ૯

ધનવસહી ખિરાજે રે, ધનપતસિંહતણી,
મંદિર અતિ શોલે રે, કૃતિ જાણે ઈદ્રતણી. સિ. ૧૦

સંવત ઓગણીસે રે, ઓગણુપચાસનો,
ધર્મચંદ શોઠ લાવે રે, સંધ શ્રી સૂરતનો. સિ. ૧૧

મોહનમુનિ આવે રે, શુરૂ શુષ્ણુવંત ઘણ્ણા,
તસ હસ્તે પ્રતિષ્ઠા રે, ઓચ્છવ થાય ઘણ્ણા. સિ. ૧૨

મહેતાખ કુમારી રે, સ્મારક કયું ભાવે,
દર્શન ત્યાં કરતા રે, હુઃઅ હુરિત જવે. સિ. ૧૩

દર પગલે ડગલે રે, પાપ સકલ નાસે,
વસ્તુપાળે કરાવ્યો રે, માર્ગ ભલો વિલસે. સિ. ૧૪

યાત્રા ભલી સહુને રૈ, થાએ એહ થકી,
પથ ગ્વાન તપસીને રૈ, સુખકર એહ નકી. સિ. ૧૫

ગયા ઈથજ રાણ રૈ,* આવ્યું સ્વરાજ ધૃહાં,
દાકોર ને રાણ રૈ, સહુ કોઈ દ્વર થયા. સિ. ૧૬

થયો દેશ સ્વતંત્ર રૈ, લોકશાહી આવી,
રખોપા-કર સહુ ગયા રૈ, આજાહી લાવી. સિ. ૧૭

કર્યા સુલલ પગથિયા રૈ, બાલક વૃદ્ધ થઠે,
ગાએ જિનગુણું સહુ કોઈ રૈ, આનંદ ચિત્ત વરે. સિ. ૧૮

આવ્યો પહેલો હડો રૈ, ભરત ચરણું નિરખો,
ચહેરતી ભરતના રૈ, પ્રથમ શાસ્ત્રે પેખો. સિ. ૧૯

પછી પેખ્યો કુમાર કુંડ રૈ, પગલા જિનપતિના,
નેમિનાર્થજિનંદના રૈ, વરદત ગણુધરના. સિ. ૨૦

તેમ ઋષલ પ્રભુનાં રૈ, વંદન લક્ષ્મિ કરો,
ભવ કોડનાં ક્ષણુમાં રૈ, પાતક સર્વ હરો. સિ. ૨૧

માતા હિંગલાજ દીઠા રૈ, અંખામાત તિહાં,
ઔષધ રસસ અહ રૈ, વિપુલ વનરપતિ જયાં. સિ. ૨૨

કલિકુંડ પારસનાં રૈ, પગલાં લ્યાં લેટો,
હુરિતો સહુ લવિના રૈ, પાતક સર્વ મટો. સિ. ૨૩

આવ્યા શાશ્વત જિનનાં રૈ, પગલાં ચિત્ત હરૈ,
દેહરી બહુ કોરણી રૈ, સહુના ભાવ ઠરે. સિ. ૨૪

યોગી મુનિ ધ્યાને રૈ, તપ તપવા કાજે,
ખહુ ઉચ્ચિત છે સ્થાન રૈ, સુંદર ત્યાં ગાજે. સિ. ૨૫

શ્રીપુણ્યની દેહરી રૈ, મન હરતી દીસે,
આત્માની શાંતિ રૈ, જઈ વસીએ લાસે. સિ. ૨૬

હૃરખાઈનો કુંડ રૈ, આવ્યો તળીઆમાં,
ગાઠ દીકો જિલ્લાંદનો રૈ, હર્ષ વધ્યો હિલમાં. સિ. ૨૭

ઉત્સુક મન થાએ રૈ, પ્રભુ કયારે લેટે?
દાદાના ચરણે રૈ, મસ્તક કરું છેટે, સિ. ૨૮

કષણું થોડા રહ્યા છે રૈ, દાદાને મળવા,
સાર્થક નરભવનું રૈ, પાતિકદળ હણુવા. સિ. ૨૯

દ્રાવિડ વારિભિદ્ય રૈ, મુનિ પગલા દીઠાં,
તપ તપી ત્યાં જેહનાં રૈ, કર્મો સહુનાડાં. સિ. ૩૦

આઈમતો નારદજી રૈ, દ્રાવિડ મુનજનની,
વારિભિદ્ય મુનિની રૈ, મૂર્તિ મનહરણી. સિ. ૩૧

કરી મુનિ દર્શનને રૈ, સહુ હુઃખને હરીએ,
તેહના શુણુ ગાઈએ રૈ, સહેજે ભવ તરીએ. સિ. ૩૨

રામ લરત ને શુક મુનિ રૈ, શિલંકાચાર્ય થયા,
થાવચ્ચા મુનિવર રૈ, આહીંઆ આવી રહ્યા. સિ. ૩૩

કરો દર્શન તેના રૈ, મન આનંદ વરો,
પાતિક ભવભવનાં રૈ, કષણમાં હર કરો. સિ. ૩૪

આઠ્યો હુંકડો મારગ રૈ, દાદાની હુંક તણ્ણો,
હવે લેટશે જિનવર રૈ, આદિ પ્રભુ જણ્ણો. સિ. ૩૫

નલી ને મચાલી રે, ઉવચાલી લેટચા,
ક્ષારના કેમ રક્ષક રે, પાપ સહુ નાઠા. સિ. ૩૬

એહને નમે ભાવે રે, જ્ય જ્ય ગિરિ એલોા,
મન આનંદ ઉલ્લયો રે, અંતરપટ એલોા. સિ. ૩૭

ઉંઘેા સૂરજ આત્મનો રે, ઉલ્લાસ ખહુ મોટોા,
લેટશું દાદાને રે, પુષ્ટયનો નહિ તોટોા. સિ. ૩૮

ઉત્તરો થાક સધળો રે, આનંદ ચિત્ત ધણોા,
જ્ય જ્ય સિદ્ધાચલ રે, જ્ય જ્ય ઋષલતણોા. સિ. ૩૯

જ્ય જ્ય આદિ જિનવર રે. જ્ય સુત નાલિતણોા,
જ્ય સુત મરુહેવી રે, જ્ય જ્ય હૃદ ધણોા. સિ. ૪૦

સિદ્ધગિરિ એ પવિત્ર રે, કે સેવે ભાવે,
કહે બાદેન્હુ તેહના રે, પાતિક સહુ જવે. સિ. ૪૧

કૃપાદિપ્રાણ
શત્રુંજય દ્વારા

૫. શ્રીઆદિનાથ દાદાદર્શન

* દુઃખ * *

દર્શન આદિ જિનંદા, ભવનિસ્તારષુંહાર;
નેથી અનંતા પામિયા, સહેજે ભવજલ પાર.

દાળ પાંચમી (દેશ—આવો આવો પાસજ મુજ મળીએ.)

ચુગાદિ જિનંદળ મુજ લેટચા રે, મારા ભવભવનાં દુઃખ મેટયાં.
ચુગાદિ—(આંકળી)

રામખોળ પ્રથમ તિહાં આવે રૈ, સહુ ભાવિક તણ્ણા મન લાવે રૈ;
સાવ લાદિત ઉચિત મન લાવે. યુ. ૧

મોહનલાલ વલ્લભ પુણ્ય પાણા રે, નેહ ઔરંગાખાદવાળા રે; પંચ શિખ પ્રાસાદ વિશાળા, ચુ. ૨

નરશી કેશવજીની ટુંક રે, માર્ગ એહ નિકટનો દેખ રે;
ટુંક દશમી ગણ્યાએ એ પેખ, યુ. ૪

આવી વિમલવસહિ પુણ્ય ધામ, રૈ, શાંતિનાથ મંદિર સુખભાગુ રૈ;
માતા ચક્રેશ્વરી ધર્મપ્રાણુ, યુ. ૫

नेमनाथ विवाहनी चोरी रे, पशु कंहने जन सारी रे;
प्रलु नेमि जिनां अलिहारी, यु. ६

એહ વિમલ મંત્રોચે નિપાવ્યું રે, પુણ્ય તેથી અનંતું પાયું રે;
જેહ ભવ્યતણે મન સાવ્યું, યુ. ૭

ઇહાં વિવિધ પ્રથિત પુષ્ટયવાન રે, નિપળવ્યા મંદિર બહુ વાન રે;
હરે મોહ ભમત્વનાં માન, યુ. ૮

यं ह नृपति कथा विख्यात रे, कुकडो थयो नर साक्षात रे;
सूर्यकुण्ड धण्डु प्रख्यात, यु. ६

હેમચંદ્ર મુનિ ઉપદેશે રે, કાલમહિમા ગણીને ખાસ રે;
કહે ગુણત તે કુંડ નિવાસ, યુ. ૧૦

नृप कुमारपाणे निपाव्युं रे, आदिनाथ मंदिर मन भाव्युं रे;
भविजन ते परमपद पायुं, यु. ११

એમ વિવિધ ધણ્ણા પ્રાસાદ રે, જાળે માંડે છે આભથી વાદ રે;
હેવહું દુષીનો થાય નાદ,
ચુ. ૧૨

એહુ હેવનગર જગ ગાલે રે, ધંટનાદ વિજય ધવનિ વાલે રે;
તીર્થરાજ જગતમાં બિરાલે,
ચુ. ૧૩

કપર્દિ યક્ષ અભિરામ રે, સિંહુરભૂષિત જસ વાન રે;
કરે નમન કંઈક અકિતવાન,
ચુ. ૧૪

શત્રુંજય ને શુણુ ગાવે રે, મહાત્મ્ય ધણું ને વધાવે રે;
ધનેશ્વરસૂરિ મન ભાવે,
ચુ. ૧૫

મૂર્તિ સ્થાપી સૂરિરાજ રે, નમતા શિષ્યો મુક્તિત કાજ રે;
નેહ સંસારજળનાં જહાજ,
ચુ. ૧૬

સૂર્યકુંડ તથા ભીમકુંડ રે, ત્રીણે છે ઈશ્વર કુંડ રે;
લધુ કુંડ ને પુણ્ય અખંડ,
ચુ. ૧૭

પ્રભુ નહુવણુને ને જલ આપે રે, ભવભવનાં પાતિક કાપે રે;
પ્રભુભક્તિ ને મન રોપે,
ચુ. ૧૮

હાથી પોળ વિશાળ તે આવે રે, ભન્ય ચિત્ત હરે મન ભાવે રે;
માંગ હાદાના ચરણું ખતાવે,
ચુ. ૧૯

હીઠી રત્નપોળ હવે ખાસ રે, વધ્યો હૃદયતણો ઉદ્ઘાસ રે;
થયો મુક્તિનગરીનો ભાસ,
ચુ. ૨૦

મહૃહેવીનંદન આદિનાથ રે, નેહ તીર્થપતિ પ્રભ્યાત રે;
જગ ડંકો વાગે છે વિખ્યાત,
ચુ. ૨૧

દર્શન પ્રભુ ઋખભનું થાય રે, ભવ કોડનાં પાતિક જય રે;
હવે આનંદ અંગ ન માય,
ચુ. ૨૨

- પ્રભુ દર્શન પૂજન કરીએ રે, સેવાલક્ષીત વિવિધ અનુસરીએ રે;
સહેલે તિહાં મુક્તિને વરીએ, ચુ. ૨૩
- સત્યાશી પંદરસોાની સાલ રે, માસ વૈશાખ ૫૬ મુવિશાલ રે;
કૃષ્ણ પક્ષની જ્યે તિર્થ ભાલ, ચુ. ૨૪
- પ્રભુ કીધી પ્રતિષ્ઠા ખાસ રે, દેહ મુક્તિતણો છે વાસુ રે;
વરત્યો જ્ય જ્ય સુવિલાસ, ચુ. ૨૫
- મૂળ ખાડુડ મંત્રીનું ચૌત્ય રે, તેહ સમરાંયું છે નિલ્ય રે;
પ્રાચીન ઘણું છે એ કૃત્ય, ચુ. ૨૬
- નંદિવર્ધન પ્રાસાદ નામ રે, હીરવિજય પ્રદર્શિત તામ રે;
તેજપાળ સોની હીએ નામ, ચુ. ૨૭
- ધૂળીઆના ડુજુમતી શોઠ રે, સખારામભાઈ બહુ શેષી રે;
આરસ કરે પ્રભુજીને લેટ, ચુ. ૨૮
- વેણુચંદ મહેસાણુનિવાસી રે, ધરધર ઇરે થઈને પ્રવાસી રે;
થયા સ્વર્ગતણુા તે નિવાસી, ચુ. ૨૯
- કરી ટીપ આરસની મોટી રે, પ્રસ્તરમય મંદિર કોઠી રે;
સહુ કીર્તિ ગાએ જસ મોટી, ચુ. ૩૦
- પુંડરિક ગણુધરતનું દેહરું રે, કરમાશા નિર્મિત સારું રે,
વસ્તુપાળનું પણ મનહારું, ચુ. ૩૧
- ગણુધર પગલા સુવિશાલ રે, ચૌદ્દોને બાવન તિહાં ભાલ રે;
મંદિર છે ઘણું લ્યાં વિશાળ, ચુ. ૩૨
- રાયણુ તળે આદિ જિનંદ રે, પગલા દોખી થાય આનંદ રે;
ટળે ભવભયના સહુ બંધ, ચુ. ૩૩

શોઠ દસપત્રાઈ નિપાઈ રે, ઢેહરી બહુ સુંદર પાઈ રે;
મન સાવદરા શુલ લાઈ, યુ. 34

અણાપદ મંહિર થાપે રે, સમ્મેતશિખર સુખ આપે રે;
કરે સમવસરણ ધ્વજ રોપે, યુ. ૩૬

એમ વિવિધ મહિરથી ભરિયું રે, સ્વર્ગાલુચન સમું મન ફરિયું રે;
શાંતિ અમૃત સુખ વરિયું રે. બુ. ૩૭

શુણ્યો ભક્તિ ધરી ગિરિરાજ રે, વધ્યો ચિત્ત પ્રમોદ અવાજ રે;
થયો બાલેન્દુ સુખલાજ, યુ. ૩૮

૬. અન્યાન્ય ટૂંક વર્ગન

* ८१ *

લક્ત ધારા ગિરિરાજના, રચના કરે વિશાળ; વિવિધ દંડ છવે વખરિંબં, સખતા મંગલમાલ. ૧

ਫਾਲੀ ਛੁਕੀ (ਫੇਰੀ—ਤਾਂਧਲ ਟਹੂਕ ਰਹੀ ਮਧੁ ਬਨਮੇਂ)

સુમક્તિવંત લહે ગિરિ દશાન,

અવભય પાપ હુરે એક ક્ષણુમેં. (આંકડી)

મુંખાપુરવાસી મોતીશા, દશેન કરી હરએ નિજ મનમેં;
હેખી કુંતાસરની ખાઈ, ગૂઢ વિચાર રચે નિજ ચિત્તમેં.

संभ. १

શેડ હઠીલાઈ સહ કરી સંકેત, ખાઈ પુરાવા નિશ્ચય વિરચે;
ધન અઠળક ખરચી પૂરે તે, મરુટેવી શિખર સમાંતર હેતે.

સમ. ૨

નલિનીગુલમ વિમાનની રચના, મંદિર સુંદર ઉપર વિરચે;
શેડ હઠીલાઈ. અમર દમણુંા, શેડ પ્રતાપાદિક ધન ખરચે.

સમ. ૩

શેડ મોતીશા ભાવના ભાવે, સ્વર्ग સિધાવ્યા પ્રતિષ્ઠા પૂર્વે;
સંવત ત્રાણું અઠારસે વરસે, પૂર્ણ કર્યો સંકેત સુહર્ષે.

સમ. ૪

ખીમચંદ્ર સુપુત્રે કીધી, ચૈત્ય પ્રતિષ્ઠા ધર્મ સંકેતે;
અમર પિતાનું નામ કરાવ્યું, આનંદમંગલ શાંતિ સુહેતે.

સમ. ૫

ખાલાલાઈ ટૂંક હરે છે, ચિત્ત લવિકનું સમકિત કાજે;
ત્રાણું અઠારસે સાતની રચના, સિદ્ધાચલમાં લ૦૨ બિરાજે.

સમ. ૬

અદ્ભુત આદિ જિનેશ્વરકેરું, મંદિર સોણશે છારીમાં કીધું;
દૌલતાખાદના ધર્મદાસળ, પુણ્ય કરી જેણે બહુ કૃળ લીધું.

સમ. ૭

રાજનગરના પ્રેમચંદ મોઢી, ટૂંક કરાવે સુંદર રચના;
અઠારસે ત્રેતાલીસ સાલે, સ્થાપે મંદિર બિંખ જિનંદના.

સમ. ૮

પ્રસ્તર કોરણુા મનહર કીધી, કેદ્ધક કરાવે મંદિર જિનના;
વિવિધ ધણી પુણ્યશાલી કરાવે, વિવિધ અલંકૃત ચ્યત્ય પ્રભુના.

સમ. ૯

શાંતિદાસ કુલદીપ હીમાલાઈ, ટૂંક બંધાવે શત્રુંજ્યમાં;
છારી અઠારસે સ્થાપના કીધી, બૈલ્ય પ્રતિષ્ઠા વિમલાચલમાં.

સમ. ૧૦

વિવિધ તિહાં કેઇ મંદિર રચના, લવિક કરે પ્રાકાર સકલમાં;
પુંડરિક ચોમુખ મંદિર શોલે, અજિત જિનેશ્વર ભુવન તે સ્થળમાં.

સમ. ૧૧

ઉજમવસહિ ગિરિશાંગ દ્વિપાવે, નંદીશ્વર રચના મનોહારી;
ચૌમુખ સત્તાવન નિપળવે, વિવિધ શિખર નામાંકિત સારી.

સમ. ૧૨

ઉજમ ફર્દ સહુ હેતે વખાણે, નગરશોઠના ફર્દજ જાણી;
ત્રાણું અઠારસે સાલમાં રચના, લવજલતારક નાવ એ માની.

સમ. ૧૩

સાકરચંદ વસાવે વસહી, ત્રાણું અઠારસે સ્થાપન કીધી;
ખહુવિધ મંદિર વિવિધ દેરીએ, ગુચ્છક સુંદર આતમસિદ્ધિ.

સમ. ૧૪

છીપાવસહી ભાવસાર બંધાવે, એકાણું સત્તારસેમાં સુજાની;
ત્રણુ મંદિર સુંદર કરે રચના, લક્ષ્મિ કરે ફ્રલ મોક્ષનું માની.

સમ. ૧૫

અજિત ને શાંતિ જિનેશ્વર દેરી, સન્મુખ રચના કીધ સુજાની;
એકની લક્ષ્મિ તે પૂંડ ખીજને, આપત્તિ એ તિહાં જાનીએ માની.

સમ. ૧૬

મુનિ નંદિષેણ પંડિતે કીધી, અજિતશાંતિ સ્તવના ખહુ સારી;
રાગ તાલ મંગલ કરી રચના, મનહર દીપે મોહને વારી.

સમ. ૧૭

કીધી અધિષ્ઠાયક હેવોએ, જોડમાં સત્ત્વર બન્ને દેહરી;
લક્ષ્મિ લવિકની ઉત્ત્રત હેખી, પૂરે આસ તે અંતરકેરી.
સમ. ૧૮

પાંડવ મંદિર કુંતામાતા, દ્રૌપદી પ્રતિમા દર્શન થાવે:
સમવસરણુ સિદ્ધ્યકની રચના, ચૌદ રાજલોક ચિત્ર રચાવે.
સમ. ૧૯

મરુહેવી માતા મોક્ષમંદિરમાં, ઋષભહેવ પર્વ સિદ્ધિ પાયા;
જોવા પુત્રવધૂને છેતે, માર્ગ સુલભ કરે નિજ મન લાયા.
સમ. ૨૦

દર્શન સિદ્ધગિરિનું થાવે, પ્રથમ શિખર એહ દૃષ્ટિપથમાં;
લવ્યજનો આનંદને પાવે, મરુહેવી સ્મરણુ કરી નિજ મનમાં.
સમ. ૨૧

મરુહેવા શિખરે ચૌમુખ રચના, હુંક ચૌમુખજીની બંધાવે;
સદાસોમજી રાજનગરના, ધર્મ જાળી તે મોટે લાવે.
સમ. ૨૨

સોળસે પંચાતેરમાં એ કીધી, સુંદર રચના ઉચ્ચ શિખરમાં;
ખરતરવસહી નામ ધરાવે, બાધ્ય વિલાગને પ્રગટ છે જનમાં.
સમ. ૨૩

આગણીસે એકવીસમાં કીધી, નરસી નાથાએ મંદિર રચના;
લક્ષ્મિ લાવના જગી મોટી, શાંતપણે કરી દેવસ્થાપના.
સમ. ૨૪

અગ્નારમી એ હુંક ગણ્યાવે, વિવિધ મંદિર દેહરીની ઘરના;
દર્શન કરતાં આનંદ આવે, બાલેન્હુ મનમાંહે લક્ષ્મિની રટના.
સમ. ૨૫

૭. સંધવણુ

(દશ)

સંધ લેછ ગિરિવર ગયા, વચ્ચિયો ધર્મતો રંગ;
 વાજિંતો વાગ્યા ધણા, પ્રભુગુણ ગાતા છંદ. ૧
 સંધવી પદ્ધત કેદ થયા, કરતા મુક્તિનિવાસ;
 તેહનાં ગુણ હવે ગાઈશું, સુખનો ધરી ઉદ્ઘાસ. ૨
 દાળ સાતમી (દિશી-કડખાતી-ચંગ રણરંગ મંગલ હુના)

સંધપતિ સંધ લેછ વિવિધ આવે ઈહાં,
 વિરલ નર ભવતણો લાલ લેવા. (આંકણી)

પ્રથમ નૃપ ભરત આડંખરે આવિઆ,
 દંડવીરો પછી સંધસેવા;
 તીર્થયાત્રા કરી સગરરાજે પછી,
 લબ કર્યો સફ્રલ પ્રભુ અકિતમેવા. સંધ. ૧

અર્ધશત કોડ ને લાખ પંદર વલી,
 સહસ પોણા સહુ સંધ આવ્યા;
 ભક્તિભાવે કરી તીર્થવંદન તિહાં,
 સિદ્ધગિરિરાજની સેવ ભાવ્યા. સંધ. ૨

મંત્રી ખાહડ કરે તીર્થઉદ્ઘારની,
 મંત્રણ્યા કર્મચારી સંગાથે;

હીન વેષે તિહાં ભીમ* આવક વહે,
અર્પણા નિજ મૂડી સર્વ સાથે. સંધ. ૩

મુગધ થઇ તે પ્રશાંસા કરે ભીમની,
લાગની ચિત્તમાં શુદ્ધ ભાવે;
નિજ અને તેહના લાગ ઔદ્ઘર્યની,
સામ્યતા હેખી મન પ્રેમ આવે. સંધ. ૪

સ્વિદ્ગિરિનો છ'રી પાળતો સુવિધિએ,
સંધ આદર્શ કુમારપાળે;
ગાજતેવાજતે લાવિયો ગિરિવરે,
હેમચંદ્રાદિ મુનિવૃંદ ચાલે. સંધ. ૫

* આહુડ મંગી મંહિરો બંધાવવા માટે મંત્રણ કરી રહ્યા હના, ત્યારે ધીની ફેરી કરનારો એક ગામડાનો આવક ભીમ એણે પોતાના સમસ્ત જીવનની કમાણી (માયા-મૂડી) ને અત્યંત નજીવી હનો તે આ મહાન કર્યાં અર્પણ કરવાની ઈચ્છા જણાવી. મંગીએ એની શુદ્ધ ભાવના અને અનુભુ ઔદ્ઘર્ય જોઈતે (સાત ઇછા) સ્વીકારી. તે ભીમ ધેર ગયો. ક્રી આ તેના ઔદ્ઘર્યથી ચીઢાઈ વઢવા માંડી ત્યા એની ગાય ખીંચો ખેંચી દોડવા માંડી. ક્રીએ તે ખીલાના ખાડામાં જોયું તો ત્યાં દ્વય જણાયું. મંત્રીશર તેની પાછળ છૂપી રીતે આવતા જ હતા. તેમણે આ દ્વય જોયું. ભીમે તરત જ તે દ્વય મંત્રીશરના ચરણે ધર્યું અને ધર્મકાર્યમાં વાપરવા વિનયું આહુડે તેની ભાવનાની ધર્યી પ્રશાંસા કરી અને પોતાથી પણ તે ભાવનામાં દેટસો આગળ વધેલો છે તે જણી તેની પોતાના ઔદ્ઘર્ય સાથે સરખામણી કરતાં. પોતા કરતાં એનું ઔદ્ઘર્ય મંગીને અત્યંત શ્રેષ્ઠ જણાયું.

હુય ગજાદિક રથો તંખુ ડેરા ધણા,
વિવિધ સૈનિક તણો વૃંદ ચાલે;
વિજય ડંકો વગાડ્યો ખરા ધર્મનો,
જેન ઉત્કર્ષ જગમાંહિ મહાલે. સંઘ. ૬

તીર્થમાલા શુરૂરાજ આજા કરે,
. નૃપતિ કંઠે ઠવો ઉચિત જાણી;
નમ્રલાવે નકારે તદા રાજવી,
*જગડુશાને સમર્પો સુવાણી. સંઘ. ૭

પુનડશા શ્રેષ્ઠ નાગોરના રહીશ જે,
સંઘ લાવે નગાધીશ પાએ;
વસ્તુપાલે તદા સંઘ સન્માનનિઓ,
ઉચિત સુરનેહ મનમાંહિ ભાવે. સંઘ. ૮

* કુમારપાળને તીર્થમાળા પહેરાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે
આવણેના વતો પૂર્ણ રીતે અદ્ધણુ કરવાથી ખંડીએ રાજનો તેનો
લાભ લઈ ભારી રાજ્ય ઉપર આકમણુ કરશે માટે શ્રી હેમચંદ્રસ્વરીને
નિનંતિ કરી કે: યોએ આવકને માળા પહેરાવો. ત્યારે જગડુશા તરફ
આચાર્યશ્રીની નજર હરી. તેમના પિતા હાસુ શેહ પરિયહપરિમાણ વત
લીધું હતું. તેણી તેમની પાસે વષેલું દ્રવ્ય ખરચવાતી તેમને સચના
કરાં પોતાની પાસે જુદા કાઢેલાં અમૃલ્ય રતનો કાઢી આપી તે દ્રવ્યનો
વ્યચ કરવાતી આજા ભાગો. કુમારપાળો તેમને જ તીર્થમાળા પહેરા-
વનાં નણુંન્યું. તે જેઈ જગડુશા પોતાની ભા પ્રત્યે દોડી ગય. તેમના
ચરણે પડી તેમને જ એ માળા પહેરાવવા આગ્રહ કર્યો. ઉચિત
જાણી ધારણાતાને માળા અર્પણુ કરવામાં આવી અને દ્રવ્યનો વ્યચ
તીર્થકારના કાર્યમાં કરવામાં આવ્યો.

ખારશે જ્યાશીમાં તીથંને બેટવા,
 વસ્તુ ને તેજને લક્ષ્ણ જાગી;
 અમિત ગાડા ધણું ભાઈ પદ્ધયંકને,
 વિવિધ શ્રાવકતણું વૃંદ રાગી. સંઘ. ૮

*માર્ગમાં નાનું ખીમા જલો શ્રાવક,
 વિનંબે નિજ ધરે સંઘ આવે;
 હૈન્થની જવનિકામાં વસ્તું અતુલ ધન,
 પાલ બંધુ તિહાં મુખ થાવે. સંઘ. ૧૦

* વસ્તુપાળ તેજપાળ સંઘ લઈ જતા હતા. માર્ગમાં ખીમા નામના એક ગામડીએ શ્રાવકે આવી પોતાને ત્યાં પદ્ધારવા વિનંતિ કરી. તેના દીનવેષ જોઈ કોઈ ધારતું ન હતું કે, એ આવા મોટા સંધની જ્યવસ્થા રાખી શકાશે. ખીમાએ પોતાને ધેર પ્રભુપતિમાં છે એમ જણ્ણાંયું. એની ઈચ્છા જોઈ વસ્તુપાળ તેના કુંપડે પહોંચ્યા. એક બોયરામાં તેમને તે લઈ ગયો. ત્યાં સુંદર પ્રાસાદ જેવું મંહિર જોઈ આનંદ થયો. ખીમાએ જણ્ણાંયું કે તે પોતે વૃદ્ધ થઈ ગયો છે માટે આ પ્રભુબિંદુ શ્રી શત્રુંજય ઉપર પદ્ધરાવવા સાથે લઈ જાવ. મંહિર માટે મેં થોડી રકમ કાઢી મુક્કી છે. મંત્રી આશ્રયચક્તિ થઈ ગયા. તેમણે ચુંભતિ આપી. ત્યારે ખીમાએ વિનંતિ કરી ‘વખત વધું થઈ ગયો છે,’ એમ કઢી એક ખારણું ઉધાર્યું. ત્યાં બોયરામાં અનેક જાતના રસોઈ તૈયાર રાખી હતી, આ ચમટકાર જોઈ મંત્રી વરના આશ્રયનો પાર રખો નહીં. તેમણે સંઘ સાથે ત્યાં બોજન કર્યું. ખીમાની ઈચ્છા પૂર્ણ કરી. ખીમાને સાથે લઈ જત્રા કરી ખીમાનો જ્દેશ પૂર્ણ કર્યો.

કુચિમાં નગર લદ્દેખરે રાજુયો,
જગડુશા શોઠ ધનવાન ભાવી;
જગતતારણુ હુકળે મહાત્મા કરે,
અજનું હાન કરુણા જગાવી. સંધ. ૧૧

તેરસે સોળમાં સંધ કાઢે તદા,
તીર્થ શત્રુંજ્યે ભાવ લાવી;
બંધુજન નારિ પરિવાર સહુ ભાવથી,
સંધભક્તિ કરે ઉચિત ભાવી. સંધ. ૧૨

માળવામાં રહ્યા તીર્થ માંડવગઢે,
શોઠ પેથડ થયા ધનદ લેવા;
તેરસે વીસમાં સંધયાત્રા કરે,
મોક્ષનો સુખદ તે માર્ગ લેવા. સંધ. ૧૩

જાવડ સમર ઉદ્ધાર તે કાળમાં,
સંધ આંદ્યા અસંખ્યાત ભાવે;
નૃપમહારાજ ને મંત્રીઓ બહુ થયા,
શ્રાવકેની ન સંઘ્યા ગણુંએ. સંધ. ૧૪

અહુમહાભાદથી વાડીલાઈ સંધપતિ,
શોઠ છાટાલાઈ સાથ જવે;
એંગણુંશે એંગણુસાડમાં નીકળ્યો,
સંધ નિજ આત્મકદ્વયાણુ કાને. સંધ. ૧૫

નેમિસૂરિ સાગરાનંદસૂરિ તથા,
વિજયગંભીરસૂરિ સિધાવે;

સિદ્ધિસૂરિ મહા મુનિવરે સાથમાં,
સંધ જાગા કરે શુદ્ધ લાવે. સંધ. ૧૬

છાતેર એણાણુસે સુરતના સંધવી,
જીવણુલાઈ લેઈ સંધ આવે;
સાગરાનંદસૂરિ પધારે તિહાં,
તીર્થસેવા કરે અકિતલાવે. સંધ. ૧૭

એંશીની સાલમાં શોઠ કેશવ લલા,
દર્શનસૂરિ સહ સંધ લાવે;
રાજનગરથકી વાજતે ગાજતે,
સિદ્ધગિરિ લેટવા લોક જવે. સંધ. ૧૮

ચારાસી સાલમાં શોઠ જીવાલાઈ,
રાધનપુરથકી સંધ લાવે;
અદ્રસૂરિ તણ્ણા સહૃપદેશે ગયા,
ગિરિવરૈ લેટવા ખૂહુલ લાવે. સંધ. ૧૯

સાગરાનંદ ને નેમિસૂરિ તણ્ણા,
સહૃપદેશે તિહાં સંધ આવ્યો;
સાલ એકાણુંમાં રાજનગરે વધ્યો,
ધર્મ ઉત્સાહ આનંદ મહાવ્યો. સંધ. ૨૦

શોઠ માણુકલાઈ સંધ કાઢે લલો,
સહસ પચીસ જન સાથ થાવે;
પાળતા ‘છ’ રીતે ધર્મની લાવના,
વિમલગિરિરાજને ન અભાવે. સંધ. ૨૧

साल चोराणुमां पोपटलालल्,
 चिमनसाई सहु संघ लावे;
 भोडनसूरि ने ने भि सूरि तथा,
 सागरानं ह सूरि सिधावे. संघ. २२

तीर्थमाला माहा वही तिथि छठनी,
 अमर पड़हा ललो त्यां अजावे;
 राजनी मान्यता नित्य प्रति वर्षनी,
 पुष्य कुमे लली त्यां भिलावे. संघ. २३

कैक संघवी थया कैक यात्रा गया,
 नाभ गणुना तस केम थावे?
 पुष्यशाणी धणु धर्मधारी थया,
 ल०यना चित्तमां जेह लावे. संघ. २४

संघपति संघने लेई यात्रा करे,
 अभित शुलकर्मने जे निपावे;
 धन्य ते भ०यज्ञन कर्मभल परिहरी,
 आल कहे मुहितमां वास थावे. संघ. २५



૮. તીર્થરક્ષણ*

(દુષા)

પ્રામાલિક વૃત્તિ ધરી, તીર્થરક્ષણ કરે જેહ;
 અદળક લક્ષ્મી તસ પદે, આદેશે ધરી નેહ, ૧
 દ્વારદ્વયને સાચવે, ધર્મલાવ ધરી ચિતા;
 તસ ધર કમલા સ્થિર રહે, દુઃખ ન તસ લચ છોત. ૨

૮૩ આઠમી (દેશી—ગિરારે ગુણુ તુમતણુ)

તીર્થરક્ષણ ફ્રલ અતિ ધાણુ, કોઈ ન તોલે આવે રૈ;
 પુષ્ટય અતુલ પામે લવિ પ્રાણી, પાપપટલ સહુ જાવે રૈ.

આંકણું.

ઉદ્ઘારકારક પ્રાચીન કાલે, તીર્થરક્ષણ કરે હેતે રૈ;
 એહ પરંપર બહુવિધ ચાલી, કાર્ય અભિડિત જેતે રૈ. તી. ૧

* સંવત ૧૫૧૨ માં મહભાષ્યાહના વખતમાં મોટો દુકાળ પજો, ત્યારે હાળાના શેઠ ખીમા દેશારે પીડિતોને છૂટથી અનાજ પૂરું પાડ્યું. તેથી બાદથાહે તીર્થરક્ષણ કરવા માટે શેઠને છૂટથી મદદ આપવાનું કખુલ કર્યું. સંવત ૧૬૮૬માં શેઠ શાંતિદાસ સહસરણને શહાજહાન બાદથાહે શ્રી શનુંનય, શાંખેશ્વર, કેશરીચા, અમદાવાદ, સુરત, ખંલાત અને રાધનપુરનાં જૈનમંહિરો અને શ્રી સંધની મિલકતના બોગવાનોના ખરીતો કરી આપ્યો. તે વખતે યાત્રાળુંએ વિશેષ સંપ્રામાં આવાના રહેવાથી તેમના રક્ષણુનો બદલો કાઢી ગરાસીઓને ખુશી સુજાય અપાતો હતો. પાણ્યથી તેમાં તકરાર જાગવાથી ગારીઆધારના ગોહેલોને તે કામ સૌંપાયું. તેએ જાંધનો બધી વ્યવરથા અને સંભાળ રાખતા. તેના બદલાનો નિયમ નહિ હતો તેથી તેમાં પણ ગુંચવણો પેદા થઈ. તે

પાદલિમપુર સંધ ચલાવે, શક્રુંજ્યને સેવે રૈ;
યવન ઉપરવ અહુવિધ થાતા, અણુહિલપુર પછી જાવે રૈ. તી.૨

સમરાશાહુ સરહાર દિવ્દીના, દેશદશાના પુત્ર રૈ;
ઉદ્ધાર કરી તીર્થરક્ષણુ કરતા, વંશ કરે સહુ તત્ત્રરૈ. તી.૩

સાજનશા ખંલાત પધાર્યા, ખહુ વ્યાપાર કરેવા રૈ;
વિજયરાજસૂરિ નૂતન રચના, કરતા તીર્થની સેવા રૈ. તી.૪

પાટણ રાધનપુર ખંલાતી, નૂતન સમિતિ રચના રૈ;
શિષ્ય મોકલિયા પાલીતાણુ, રક્ષણુની જસ રટના રૈ. તી.૫

પછી ગારીઆધારથી ગોહેલ કાંધાજી, બાઈ પદમાજી, બાઈ પાટલહેને
લઈ કડવો દોશી અમદાવાદ ગયા. બારોટ પરયત, જોરજી ગેમલજ
તથા લખમણજી વિગેરે સંધ જેણું ખત કરવામાં આવ્યું. નેમાં
ગોહેલાએ સંધનું મળણું ચોકી કરવી, તેના અદ્વામાં છૂટક જાત્રાણ
પાસેથી અરધી જામી, એક ગાડે અઠી જામી અને સંધ પાસેથી
સુખડી મણું ૧ અને અઠી જામી મળે તેમ હરાવ્યું. સંવાન ૧૭૧૩માં
શાન્તિદાસ સહસ્કરણુને શાહજહાને પાલીતાણા પ્રગણું બદ્ધિસ આપ્યું
અને સનંદ કરી આપી. તેજ સનંદ તેમના પુત્ર લખમીયં શેડને નવી
કરી આપી. સંવાત ૧૮૦૪ માં સુરથી પ્રેમજી પારેખ સંધ લઈને
કનાડ જ્યારે ગયા ત્યારે ગારીઆધારથી નોંધણું મળણું કરતા આવ્યા.
સંવાન ૧૮૬૪માં વખતયં શેડનો સંધ ગયો તેમને મળવા સામે
ડાડોરથી જ્નાજી આવ્યા હા. ત્યાર પછી સંવાત ૧૮૭૮માં
હીમાલાઈ શેડે કાડીઆવાડના પોલીટીક્લિનિક એજન્ટના સામે જામી,
સુખડી, ભાઈ, રાજગોર અને ચોકીપહેરો, અરસમાની સુકતાની થાય
તે ભરી આપવા. એના અદ્વામાં ઉચ્ક રૂ. ૪૫૦૦ વાર્ષિક આપવા
ડાક્ટર કાંધાજીએ હરાવ્યા. સંવાન ૧૯૧૮થી વાર્ષિક રૂપીઓ ૧૦૦૦૦ ને
સંવાત ૧૯૪૨થી રૂ. ૧૫૦૦૦ અને સંવાત ૧૯૮૪થી રૂ. ૧૦૦૦૦ હરાવ્યા.

અકુખરણેધક હીરસૂરીશ્વર, તીર્થરક્ષણુ હડ લાવ્યા રે;
ધર્મકાર્ય એહ અદ્ભુત કીધું, સંઘતણે મન ભાવ્યા રે. તી.૬

યતિ સમુદ્ધાય કરે સહુ રક્ષણુ, શ્રી શત્રુંજય આવી રે;
આચાર્યો ખહુ સાત્ત્વિક લાવે, રક્ષા કરે શુલ ભાવી રે. તી.૭

શાહજહાન નૃપતિના રાજ્યે, શાંતિદાસ શેઠ થાવે રે;
અમદાવાદના નગરશેઠ તે, તીર્થરક્ષક પદ પાવે રે. તી.૮

સત્તરસે તેર વરસે લીધું, અક્ષિસ તીર્થ તે કાલે રે.
તેહ પરંપરા ચાલી ત્યાંથી, *ખુશાલચંદ શેઠ પાલે રે. તી.૯

વખતચંદ ખહુમાન ભિલાવે, ગાયકવાડ નૃપતિથી રે;
તીર્થરક્ષણુ કરે ખહુવિધ સારું, નામ કીર્તિં ખહુ તેથી રે. તી.૧૦

* +હીમાલાઈ તસ પુત્ર પ્રતાપી, પાલીતાણુા નૃપ સાથે રે;
સંધિ કરે ત્યાં તીર્થરક્ષણુનો, વ્યવસ્થા ખહુ ભાતે રે. તી.૧૧

* ખુશાલચંદ શેઠના વખતમાં મરાઠા સરદાર પીલાળ ગાયકવાડે
અમદાવાદ જીતી દુંટનો હુકમ કર્યો ત્યારે શેઠ મેટી રકમ આપી દુંટ,
ખૂન અને અત્યાચારથી થહેરને બચાવ્યું. ગામના લોકોએ તેમને
નગરશેઠ સ્થાપ્યા અને તેમને વંશપરંપરા કાંચા ઉપર ચઢતાં માલમાં
સેંકડે ચાર આના આપવાનો ઠરાન કરી આપ્યો. તા. ૨૫-૭-૧૮૨૦
સુધી તે કર મળતો રહ્યો. ખાદ કંપની સરકારે ઉધડા રૂપીઓ ૨૧૩૩
સાતના વંશપરંપરાગત કરી આપ્યા તે હજુ સુધી મળે છે.

+ શેઠ હીમાલાઈનો વેપાર લગભગ આખા હિંદમાં હતો. રાજ્યોની
મહત્વની તકરારો તેઓ સાંભળી ઝેંસલો આપતાં. ખંડણી વિગેરે નક્કી
કરવાનું કામ પણ તેમને સેંપવામાં આવ્યું હતું. શેઠ ખહાર નીકળના
ત્યારે છડીદાર નેકી પોકારતો આગળ ચાલતો. ઉપાશ્રે જતા ત્યારે

પ્રેમાલાઈ પછી સહુ કરતા, ભારત સંધ ઓલાવે રે;
સ્થાનિક પ્રતિનિધિ શત નવ કીધા, રાજનગર મનલાવે રે. તી.૧૨

આણુંદળ કલ્યાણું નામે, ચેઢી પ્રતિષ્ઠિત કીધી રે;
ધર્માનંદ પ્રગટ કરી સારો, કલ્યાણ કદ્યાના સિદ્ધ રે. તી.૧૩
વહીવટ કરતા રાજનગરના, પ્રતિનિધિ પ્રમુખ કહાવે રે;
પ્રમુખ કર્યા તિહાં શેડ કુંધાંથી, નૂતન રચના થાવે રે. તી.૧૪

મયાલાઈ પછી લાલભાઈ આવે, પ્રમુખપદે સોહાવે રે;
ચિમનલાલભાઈ તેહ પછીથી, અચ્યપહે સ્થિત થાવે રે. તી.૧૫

શેડ મણીભાઈ પ્રમુખ થયા ત્યાં, સંધતણે મન ભાવે રે;
નગરશેડ કસ્તુરભાઈ જે, પ્રમુખપહે બહુ શોલે રે. તી.૧૬
ઓગણીસે અડસઠમાં પાછો, ભારતસંધ ઓલાંયો રે;
મનસુખભાઈ સહુમાં શોલિત, અચ્યભાગ જેણે ભજોયો રે. તી.૧૭

સંધતણે બહુમાન વધાર્યો, ધારા રચના ઓધે રે;
લાલભાઈ સરદારતણ્ણા સુત, પ્રમુખ થયા મન ભાવે રે. તી.૧૮
કસ્તુરભાઈ હાત બિરાજે, કાર્યકુશલ જે કહાવે રે;
સંધિ કરે નૃપ સાથે સારા, માર્ગ સુખદ જે કરાવે રે. તી.૧૯

બહુવિધ તીર્થ સુધારા કીધા, નૂતન સુખકર જેહ રે;
સંધતણ્ણા મનમાં જે ભાવે, કવિવર જસ ગુણુ ગાવે રે. તી.૨૦

નૂતન સુખસોપાન માર્ગમાં, વૃક્ષો દ્વિવિધ તે રોધ્યા રે;
આનંદે યાત્રા સહુ કરતા, ખાલેન્દુ ગુણુ ગાવે રે. તી.૨૧

દન હેતા ચાલતા હાં, રાજકોટમાં પોલીટીકલ દરબારમાં એમના માટે
ખુરશી રહેતી અને એદિસમાં તીર્થના કામ માટે વકીલ રહેતો. એ
વકીલનો હાં શેડ આણુંદળ કલ્યાણું પણ ભોગને છે.

૬. કળસ

(હૃદા)

સિદ્ધાચલ સ્તવના કરી, મન આનંદ ન માય;
 જે ભવિ ગાવે સાંસણે, તસ ધર મંગળ ધાય. ૧

દાળ નવમી (દેશી—ઓછા રંગ વધામણું પ્રભુ પાસને નામે)
 શ્રી સિદ્ધાચલ વર્ણવી, હેતે “ગુણુ ગાયા;
 વીરોદ્ધાસ વધ્યો ધણો, નરલત ઇલ પાયા. (આંકણી)

કિસનદાસ ભવિ શોઠ છે, મહિકાપુરવાસી;
 ભૂખણુદાસ સુપુત્ર છે, ભવિ અક્રિત વિવાસી. શ્રી. ૧

તીર્થઅક્રિત બહુલી કરી, થયા જે પુણ્યરાશી;
 તેહ તણું આથહે કરી, રચના સુવિલાસી. શ્રી. ૨

ઇયા ચિત્રપટે કરી, શત્રુંજ્ય રચના;
 તેહ નિમિત્ત સ્તુતિ કરી, થઈ પૂનિત રસના. શ્રી. ૩

અષિઅહ અંકરાશી (૧૯૬૭) માંહે, એહ રચના કીધી;
 તીર્થસ્તુતિ કરતા ભલી, મન શાંતિ સાધી. શ્રી. ૪

રંજન ભાવિનું એ કરો, મન આનંદ લાવો;
 અક્રિત અષલજિનની કરી, મુક્તિસુખ પાવો. શ્રી. ૫

ચૈ-રી કાર્તિકી પુનમે, પ્રભુ ઓગળ ગાવા;
 ભણુતાં સુણુતાં પુણ્યના, બહુ મળશે દહાવા. શ્રી. ૬

જે ભણુશે વા અક્રિતથી, હેતે સાંસળશે;
 બાદમને સમતા વધી, તસ મુક્તિ મળશે. શ્રી. ૭

ખમાસમણ્ણા

તીર્થાધિરાજના એકવીસ નામના ખમાસમણ્ણા.

દેશા : સિદ્ધાચળ સમરો સદા, સોરં દેશ મોઆર;
મનુષ્ય જન્મ પામી કરી, વંદ્દો વાર હજાર.

શ્રી શકુંજય તીર્થમાં, આદીશર ભગવાન;
નમતા પુણ્ય વધે ધારું, તેણે સુજ કોડ પ્રણામ. ૧

પુંડરીક સુગતે ગયા, પાંચ કોડ સુનિ સાથ;
પુંડરીકગિરિને નમું, સ્વર્ગભુવન સાક્ષાત. ૨

સિદ્ધિ મળે આત્માતણે, શાસ્ત્ર વહે સાક્ષાત;
સંદ્રશેત્ર તેથી થયું, નામ જગત પ્રખ્યાત. ૩

વિમલ શુદ્ધ સહુ થાય જન્યાં, પાપતણો નહીં લેશ;
વિમલાચલ પ્રખ્યાત છે, નામ પ્રસિદ્ધ વિશેષ. ૪

સુરવર ઈંદ્ર ને અપ્સરા, પ્રભુભક્તિ કરે નિત્ય;
સુરગારિ જણો એહ છે, સુરવાસો છે સત્ય. ૫

મહામુનિ કેઈ પામીયા, પરમ મુક્તિનો વાસ;
મહાગિરિ તેથી થયું, નામ અપૂર્વ નિવાસ. ૬

પુણ્યનો રાશિ વધે જીહાં, પાપી હોય પુણ્યવંત;
પુણ્યરાશિ તેથી કહે, સજજન સંત મહાંત. ૭

મોક્ષશ્રી ઈહાં મેળવે, કેઈક સાધુ અનાંત;
આપદ તેથી નામ છે, જગમાં માન્ય મહાંત. ૮

ઇંદ્ર પ્રગટ કરે ભક્તિને, નૃત્ય કરે બહુ ભાવ.

ઇંદ્રપ્રકાશ છે તેહથી, નામ પ્રસિદ્ધ પ્રભાવ. ૮

તારે સુનિજનવૃંદને, પાપીને પણ જેહ;
મહાતીર્થ તેથી કહે, પ્રણમો મન ધરી નેહ. ૧૦

શાખત છે ત્રણ કાળમાં, તારક એ ગિરિરાજ;
શાખતગિરિ તેથી કહે, એધિધીજ શિવરાજ. ૧૧

એહ ગિરિને સેવતાં, શક્તિ અમિત દદ હોય;
દદશક્તિ તેથી કહે, તુલ્ય ન આવે કોય. ૧૨

સુક્તિમાર્ગ ધીને નહીં, ગિરિસેવા વિષુ જેહ;
સુક્તિનિલય તેથી કહે, ધામ સુક્તિનું તેહ. ૧૩

સુમતિ મળે સહુ જીવને, એ ગિરિવરમાં અમૃત;
પુષ્પદંત એ નામથી, જાણે સુરનર ભૂત. ૧૪

પૃથ્વીમાં સુંદર ધણો, ૨૪૨૪ પૂનિત જેહ;
પૃથ્વીપીઠ જાણે સહુ, અવધારો ગુણગોહ. ૧૫

ભર સહુનું એ કરે, ગિરિવર સુંદર વાન;
સુલદ તેથી જાણુવો, શાંતિ સુહંકર ભાણ. ૧૬

ગિરિવર બહુ અવની વિષે, વિવિધ નામ પ્રખ્યાત;
એ પર્વત કુલાસાર્ગિરિ, સુક્તિનગરી સાક્ષાત. ૧૭

વિવિધ વૃક્ષ રાણુ ઈહાં, ગંધગુણે લરપૂર;
કદંભગિરિ કહે જેહને, કદંભ તરુ અંદૂર. ૧૮

ઉજવલ પ્રભુ ઉજવલ ગુણો, ઉજવલગિરિનાં શૃંગ;
ઉજવલગિરિ કહે તેહથી, સેવે અવિજન લૃંગ. ૧૯

વિમલ ગુણો પ્રગટે જીહાં, વિમલ સાધુ-મુનિ સંત;
વિમલાચલ કહે તેહથી, પૂજે પૂજય મહાંત. ૨૦

ઇહ પર આકંક્ષા સહુ, પૂર્ણ થાયે ઇણે ડામ;
સર્વકામદ્યાયકગિરિ, જગપ્રાયાત એ નામ. ૨૧

આશ પૂર્ણ બાલેન્હની, પ્રસર્યો રગ રગ મોદ;
ગિરિવર થુણુતાં આવીયો, આત્મશાંતિ પ્રમોદ. ૨૨

શ્રી શત્રુંજ્ય પ્રશસ્તિ અથવા શ્રી શત્રુંજ્ય પદ્ધતીસી
(શ્રી શત્રુંજ્યની સ્તુતિ મંદારમાલા જેવા દીર્ઘવૃત્તિમાં
કરી છે જે અતીવ અવાખુમનોષર છે.)

(મંદારમાલા ધત)

શ્રી શારદા હેવી વીણા ધરી હુસ્ત કાંયામૃતસ્યંહિની નંહિની,
સ્કૂર્તિ કવિની તથા કાંયવાણી કવિ વાણીથી વર્ષાતી હર્ષિણી;
તારા નમી પાદપદો સુભાવે સુસિદ્ધાચલ પ્રાથાંના ગાવતા,
સ્કૂર્તિ મને આય ગાવા ગિરિરાજ વાણીથકી ભક્તિને ભાવતા. ૧

શત્રુંજ્યાદ્રે તને ભક્તિભાવે સ્તવું કાંયખાડે ધણ્ણા ભાવથી,
તું ભારતે હેશ સૌરાષ્ટ્રમાંહે ખરેા શાશ્વતો છે ત્રણે કાળથી;
તીર્થાંકરો સિદ્ધ શુદ્ધાત્મહેવો ઋષિશ્રી આંયાં ઈહાં ભાવથી,
પાભ્યા ધણ્ણા આત્મસિદ્ધ મુનિ કેદ મુક્તિ વર્યા ભાખ્યા શાખથી.

પ્રત્યેક રેણુ ખરી પૂનિતા છે અનંતા થયા સિદ્ધ તારા શિરે,
તું રાજવી પર્વતોનો ખરેા તાહરા જે ગુણો ચિત્ત સૌનું હરે;
માટે તને લેટવાને ધણ્ણા આય હોડી જતા નિત્ય દિસે નવા,
મદ્રાસ ને ખંગ પંજાખથી ચુજારો ને મહારાષ્ટ્રી આવિયા. ૩

આકાશમાં સ્વગ્યાભૂમિ ભલા હેવતા આવતા ભાવતા શુંજના,
ધારી ધણ્ણા દિવ્ય શૃંગાર નારી ધરી હાથ ભૃંગાર વારિતણાં;
હોડે પ્રભુ દર્શા થાવા સુવેગે લર્યા થાળ કૂલે ઇણે અર્પવા,
વાને ધણ્ણા વાધ ગાને દિશાએ ન લાને પ્રભુભક્તિને શુંજવા. ૪

પૃથ્વી વિષે ભવ્ય હિમાદ્રિ તેવો ભલે હોય સહ્યાદ્રિ વિંધ્યાદ્રિ તે,
તુંગાદ્રિ મોટો જલો સ્થૂલ હેઠે ધણ્ણા લોકમાં જણુ છે હુર્ગ તે;
તેના શિરે હિમ વૃક્ષાદિ સંપત્તિ વારી સમૂહો ધણ્ણા ભવ્ય છે,
તીર્થેશ શતુંજયાદ્રિતણ્ણા તુલ્ય આવે ન કોઈ જગો દિવ્ય જે. ૫

વારિપ્રપાતો તુખારો મણિતુલ્ય વર્ષાંકૃતુ હાર મોતીતણ્ણા,
શોલે ચમત્કાર વૃક્ષો ધણ્ણા નીલ રાતા પીળા રંગ પણ્ણોતણ્ણા;
બાણો દિસે ઈદ્રના ભવ્ય સારા ગિરીન્દ્રે રહ્યા ઈદ્રલક્ષિતતણ્ણા,
જે ભવ્ય લક્ષિત ધરી ચિત્તમાંહે લને તેહ સિદ્ધિ વરે વેગમાં. ૬

વર્ષે ધણ્ણી ગર્જના જયજ્યાનંદ નાચે શચીંદ્રાદિ વર્ષાંકૃતુ,
લક્ષિથકી તે પખાળે ગિરિજાજ શુદ્ધોદકે હર્ષથી ગર્જતું;
વાતાભુ સૌગંધ અર્પે પ્રભુપાદ-પદો સહર્ષે તિહાં હેવતા,
કૂરે કરે જે અશૂચી હુરે શુદ્ધતાને સમર્પે કરી સ્વચ્છતા. ૭

વૃક્ષો ધણ્ણા રાજિ વેલીતણ્ણી કુજ ગંભીર સૌગંધ દિવ્યૌષધિ,
ટાળે ગહે માનવોના હરી હુઃખ દારિદ્રય આપે સદા શુદ્ધ ધી;
એવા ગિરિને નમો લક્ષિતલાવે હુરે કલેશ જે ભવ્ય પ્રાણીતણ્ણા,
તાર્યા મુનિ કેદ લક્તો પ્રભુના ઈહાં સુક્તિ પાખ્યા કરી પ્રાર્થના. ૮

જ્યાં કેદ તપસ્વી ઋષિ યોગ સાધે શુક્રમાં પ્રભુ નામના ધ્યાનમાં,
ભૂલી ગયા સર્વ સંસારને આત્મની ચિંતનામાં ગયા સુક્તિમાં;
જેને નહીં અજ્ઞની વા તૃષાની પ્રભુભક્તિથી શ્રેષ્ઠ તે કલ્પના,
જે છે સદાકાળ આત્માતણી ચિંતનામાં ન જેને હુજુ જલ્દીના, ૯

મહારમાલા શચીકંદ ઉકંડ ધારી અદંકાર હિવ્યાંગના,
સાનંદ શૃંગાર સોળે સળ નૃત્ય શત્રુંજ્યાદ્રિ વિષે વંદના;
તાદી હિયે તાલને ભક્તિના ગાન દેવાંગના ગાય છે શાંતિના,
થૈ થૈ કરે નૃત્ય સેવા સમર્પે હરી કલેશ હેતુ ધરી મુક્તિના. ૧૦

પ્રેમે નમું પાદ શત્રુંજ્યાદે ! કરી હર શત્રુ સહુ આત્મના,
તારા પહે હુઃખ દારિદ્રિય જાયે સહુ ભવ્યના જન્મ કોટીતણ્ણા;
વંદ્ધં તને ભક્તિલાવે ગિરિરાજ થાયે ન કોઈ થડી તુલ્યતા,
ગાવે કણ્ણીદ્રો સ્વજિહા સહુસે ન ગાઈ શકે તાહરી ભવ્યતા. ૧૧

માનાદ્રિ તુંગાદ્રિ તેવા ખલાદ્રિ ભલા નીલ આદિ ધણ્ણા લોકમાં,
ધારે શિરે શીત વાયુ સુધાતુલ્ય પાણીતણ્ણા સંથળો ડોકમાં;
તારા વિના આત્મશાંતિ ન કોઈ સમર્પે હરી શત્રુએ આત્મના,
તેં ધારિયા છે શિરે આદિ તીર્થંકરો તેહને હું કરું વંદના. ૧૨

ઉચ્ચા તથા નિભન માર્ગો ગિરિરાજ જાતા ધણ્ણા કેઈ પ્રસ્વેહના,
વાયુ હરે હુઃખ ગંધે લર્યો શાંતિ આપે હરી પૌદ્રગલી વેહના;
તેવે સમે સ્કૂર્તિ જગે મને દોષ ટાળે હરે શત્રુ જે આત્મના,
જગે પ્રભુભક્તિ ચાનંદ ઉર્મિ ધણ્ણી થાય હોને પ્રભુ વંદના. ૧૩

આવ્યા અનંતા સુનિના સમૂહો કર્યા રૂપર્શ સર્વે આણુરેણુમાં,
તેથી નિપાયા પ્રભુ ભાવનાના અસંખ્યાત મેઘો ગિરિરાજમાં;
આવે ધહું ભવ્ય પ્રાણી અને પાપકારી સહુ શુદ્ધ થાયે ધણ્ણા,
માટે નમો નિય સિદ્ધાદ્રિને ભાવ ધારી પ્રભુ આદિ હેવેંદ્રના. ૧૪

તીર્થંકરો કેદ ચોવીશીના એહ તીર્થશમાં આવિયા ભાવથી,
આચાર્યહેવો મુનિ ને તપસ્વીતણ્ણા સુપ્રવાહો વદ્ધા હેતુથી;
આવ્યા ધણ્ણા સંધ ધર્મિતણ્ણા સંધસ્કૃત ધરી અંગ સિદ્ધાચલે,
તેથી ધણ્ણો રંગ મુક્તિતણ્ણા સંગ પાપોતણ્ણા લંગ થાયે લકે. ૧૫

મોટી પ્રવૃત્તિ ધરી શુદ્ધ વૃત્તિ કરી પ્રાસ સંપત્તિ કેદ આવકે,
અર્પી પ્રલુ-પાદપદો નમી શુદ્ધલાવે વિરાગી થઈ આવકે;
અળજાવધિ રૌષ્ય મુદ્રા સમર્પી કર્યા તીર્થપ્રાસાદ તીર્થેશમાં,
આકાશથી જેહ સ્પર્ધા કરે દ્યદ માની કહે તેહ સ્વર્ગો સમા. ૧૬

પૂનીત ને સાધુ ભક્તિથકી થાય વૈરાગ્યની સાત્ત્વિકી આવના,
તે થાય સિદ્ધધાચવે ને અનાયાસ મોટી તપસ્યાથકી પાવના;
સેવે ધરી ભક્તિ શતુંજયે તીર્થપૂજા કરે જેહ શુદ્ધધાતમા,
તે સંચિદાનંદને રહે મોક્ષ પામી વરે શાંતિ આનંદમાં. ૧૭

વાયુ હરે મંદ સૌગંધ ગંભીર રેણુ પ્રલુ અંગથી શાંતિમાં,
અર્પે પ્રલુસ્નાન માટે સુગંધી સુધા તુલ્ય પાણી ધરી પાત્રમાં;
એવી કરે દ્યદસેવા પ્રલુની સુવેદી કરે હાર પુણોતણા,
દિવ્યોખધિ ગંધ કસ્તૂરિકા ચંદ્રનોથી ઘણા લાં કરે પૂજના. ૧૮

શ્રી શારદા દિવ્ય અંકાર ગંભીર વીણા બજાવી કરે પ્રાર્થના,
થાયે સહુ મુખ તે સાંસળી મંજુવાણી અણુતકાર દેવાંગના;
કાવ્યો તિહાં હસ્ત નેરી જીલા ને અલંકાર શાખ્દોતણા ધારતા,
અર્થો લર્યા ગૂઠ જેના વિષે હોય તાત્પર્ય પાપૌધને વારતા. ૧૯

છંદો ઘણા કાવ્ય અંધો સુવૃત્તો મનોહારી નિર્બંધ શાસ્ત્રોક્તા ને,
પદો અવદો સ્તુતિ નાદયદો કરે પ્રાર્થના મુખ લક્ષ્ણોક્તા તે;
ધારી અલંકાર શાખ્દાર્થ અંકાર સંસ્કાર લેળી ચમત્કારને,
આહિપ્રલુ ભક્તિની પ્રેરણુથી હરે ચિત્તવૃત્તિ વિસંવાહને. ૨૦

ચાહ્યા સુનિ કેદ સાધવીતણા સંધ ગાવે સુખે દિવ્ય સુપ્રાર્થના,
નાભીતણા પુત્ર આહિપ્રલુના સમરી ગાન આનંદ અભ્યર્થના;
માતા મરુદેવીના પુત્રને વંદીને લાવથી જન્મ સાકૃદ્યતા,
માને ઘણા હર્ષથી સ્તોત્ર ગાતા ચઢ સિદ્ધક્ષેત્રે ઝેણે દિવ્યતા. ૨૧

ખાળો ચઢે આવી આનંદમાં બોલતા જ્યુ જ્યાનંદ ઉચ્ચારતા;
નાચે ધરી લાવ દાદાતણું દર્શ આજે થશે શાંદ ને બોલતા;
નારી ચઢે લાવ ધારી સહુ વારી સંસાર માયા હરી ચિત્તથી,
સારી ભતિ ધારી હાથે લહુ વારી પ્રક્ષાલતી દેવ અંગો છતી. ૨૨

કસ્તુરિકા કેશરે મિશ્રિતા ચંદ્રાદિ સુગંધે લરી વારિકા,
અપી નવાંગે ધરી લાવ અંગે ધણું સુપ્રસંજે પ્રભુ પૂજિકા;
માળા સુગંધી કૂલેની ધણું વર્ણ આનંદ ને લાવને વર્ષતી,
અપી પ્રભુકંડમાં શોભતી સુંદરા લબ્ય લાવૈધને અર્પતી. ૨૩

ધૂમાયિતા જેહ સૌગંધને સર્વ દિગ્ભાગને ગંધ અપે ધણું,
આરાત્રિકા જ્યોત આત્માતણી આપતી દર્શ ને દિલ્ય આત્માતણું;
ઉતારતા લબ્ય લાવે વહે ગીત આદિપ્રભુના ધણી લાવના,
એવી રીતે ચૈત્ય વંદી સુખાવે ખને લીન પુણ્યોધ ને આત્મના. ૨૪

એ લક્ષ્મિની પુણ્યમાદા વિશાલા ધણું વર્ણ એમાં સુગંધીલર્યા,
ગુંથી પ્રભુલક્ષ્મિનાં તાનમાં લાન ભૂલી સ્વશક્તિ વિના સાંભળ્યા;
તે મોદ ને લક્ષ્મિના હેતુ કાજે થજે લાવિકાને સદા સૈખ્યદા,
સેવા યુગાદિ પ્રભુની ઝ્યો ખાલને આત્મશાંતિ થજે સર્વદા. ૨૫



તીર્થાધિરાજ શત્રુંજ્યનું સંક્ષિપ્ત વર્ણન



મોટા શહેરેમાં ચારે ખાળુ મનુષ્યોની વિવિધ પ્રવૃત્તિ-
ઓથી ઘેરાયેલા મંહિરો જેહાએ તેટલી શાંતિ આગી શકતા
નથી અને લાવિકેનો પરમાત્મા પ્રત્યેનો લક્ષ્ણભાવ જેહાએ
તેટલો ઉદ્દાસ પામી શકતો નથી તેથી ઉત્તત ગિરિશૂંગો કે
પર્વતો પર મહિરો બંધાવવામાં આવેલ છે. મનુષ્યો સંસારની
કે દ્રવ્યોપાર્જનની વિવિધ ઉપાધીઓથી સુક્ત થઈ થોડા
દ્વિસો તીર્થસ્થાનોમાં, ધર્મ અંશોમાં બતાવેલ હોય તેવા
શુદ્ધ વ્યવહારથી, પોતાના ઈષ્ટદેવની બની શકે તેટલી લક્ષ
કરવા ઈચ્છા રાખે છે. જૈનોએ જે જે સ્થગોને તીર્થો
તરીકે સ્વીકારેલ છે તે તે સ્થગો જૈનધર્મના તીર્થંકરોના
જીવનપ્રસંગો સાથે થોડાધણો સંબંધ ધરાવતા હોય છે
શ્રી શત્રુંજ્ય પર પ્રથમ તીર્થંકર આદીશ્વર લગવાન પૂર્વ
નવાણું વખત આવેલ છે. શ્રી ગિરનાર પર લગવાન નેમિનાથના
ત્રણુ કલ્યાણુકો થયેલા છે. સ મેતાશાખર પર વીશ તીર્થંકરો
મોક્ષપદને પામેલ છે. કુદરતી સૌંદર્યના ધામરૂપ પાવાપુરી
શ્રી મહાવીરસ્વામીની નિર્વાણુભૂમિ છે. આખૂ અને રાણુકપુર
સુંદર શિવિષ માટે પ્રખ્યાત છે જ્યારે તારંગાળનું મંહિર
સુંદર બંધણી માટે પ્રખ્યાત છે.

જૈનોના દાખિણિંદુ પ્રમાણે તીર્થ એવું સંસારથી સુક્ત
કરે-તારે તે જૈનો દેહદમન પર વધુ પડતો લાર ઝૂકે છે,
તેથી જૈનોએ ધણું કરીને પર્વતોને તીર્થસ્થાનો તરીકે પસંદ
કરેલ છે. આત્મશુદ્ધિ માટે અને પરમાત્માનો લક્ષ્ણ ને માટે

મનને નિર્મણ અને સ્થિર કરવાની જરૂર છે. વળી મનની નિર્મણતા અને સ્થિરતા દેહમન વિના પ્રાપ્ત થઈ શકતી નથી. પર્વતો પર યાત્રા કરવાથી અમુક પ્રકારની એટલે ખાવા-પીવા વગેરે અગવડો સહુન કરવી પડે છે તેથી મનને નિર્મણંતા અને સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે. વળી પર્વત પરના તીર્થસ્થાનોની યાત્રા કરવાથી આત્મશાંતિ મળે છે કારણું કે પર્વત પરના મંદિરોમાં દર્શાન, સેવાપૂજા અને જપ વગેરે કિયાઓ કરતાં મતુષ્યો આધિ, બ્યાધિ અને ઉપાધીઓને ભૂલી જાય છે. વળી કુદરતી રમણીયતાને લીધે તીર્થસ્થાનો મનને આહલાદક પણ લાગે છે. પ્રભુલલ મન સેવા-ભક્તિમાં વિશેષ આસક્તા બને છે. શ્રી શત્રુંજ્યની યાત્રા કરીને યાત્રિકોના મનમાં જે અવર્ણનીય આનંદ ઉત્પન્ન થાય છે તેવો આનંદ બીજી તીર્થોની યાત્રા કરવાથી થતો નથી. શ્રી શત્રુંજ્ય પર અનેક મંદિરો હોવાથી તેને “મંદિરોનું● નગર” પણ કહેવામાં આવે છે.

શ્રી શત્રુંજ્ય જેવી પવિત્ર અને પાવનકારી ભૂમિમાં યાત્રિકોના પૂર્વનાં હુષ્ટ કર્મેનો ક્ષય થવાથી તેમના આત્મામાં દિવ્ય પ્રકાશ પ્રકટે છે. કહ્યું છે કે:-

અકેકું ડગલું ભરે, ગિરિસન્મુખ ઉજમાળ,
કેડો સહસ ભરના કર્યાં, પાપ ખૈ તર્કાળ.

શ્રી શત્રુંજ્ય તીર્થ પર અનેક તીર્થાંકરો આવી ગયા છે તેથી શત્રુંજ્ય તીર્થ પવિત્ર અને પાવનકારી મનાય છે. તીર્થ પર અસંખ્ય મુનિવરો સિદ્ધિપદને પામ્યા છે તેથી તેને “સિદ્ધાચળ” પણ કહેવામાં આવે છે.

આ પંચમકાળમાં શ્રી શતુંજયનું પવિત્ર વાતાવરણું યાત્રાગુણોને જ્યારે તેઓ મંહિરોની અંદર રહેલી મૂર્તિઓના દર્શન કરતાં હોય છે ત્યારે એક બીજુ અદૌડિક ફુનિયામાં વિહુરતાં હોય તેવો લાસ કરાવે છે.

અદ્ભૂત જૈન કથા “તરંગવતી”ના વિદ્ધાન કર્તા અને યુગપ્રધાન શ્રી. પાદ્લિમસૂરિનું નામસમરણું કાયમ રાખવા માટે તેમના વિદ્ધાન શિષ્ય નાગાર્જુને શતુંજયની તળેટીમાં “પાદ્લિમસ” નામે નગર વસાવ્યું હતું અને તે પાદ્લિમનગર આજનું પાદીતાણું છે. ઐથ્રે રસ્તે શિહેરાર જંકશનથી પાદીતાણું જવાય છે થોડે હુર જતાં ગિરિરાજના દર્શન થાય છે ત્યારે યાત્રાગુણોના હૃદયે આનંદથી નાચી ઉઠે છે અને તેમના હૃદયમાંથી નીચેના ઉદ્ગારો એકાએક નીકળી જાય છે.

સિદ્ધાચળગિરિ લેખા રે, ધનભાગ્ય હમારા;
એ ગિરિવરનો મહિમા મોટો, કહેનાં ન આવે પાર;
રાયણ ઋષલ સમોસર્યા સ્વામી, પૂર્વ નવાણું વારા રે.
ધનભાગ્ય હમારા.

શ્રી શતુંજય લેમ મંહિરોનું નગર કહેવાય છે તેમ પાદીતાણું ધર્મશાળાઓનું નગર કહેવાય છે.

શહેરના મુખ્ય દેરાસરો

મોટું દેરાસરઃ—શહેરના મધ્યભાગમાં શોઠ આણુંદળ
કચાણુંની પેઢી પાસે આ રમણીય મંહિર આવેલ છે. આ
મંહિરમાં મૂળનાયક શ્રી આદીશ્વર લગવાન છે.

ગાડીજીનું મંદિર:—શહેરના ચોકમાં આ હેરાસર અવેલું છે. ભૂણનાયક તરીકે શ્રી પાંચનાથ લગવાનની અલોકિક અને સુંદર મૂર્તિ છે.

નરશી કેશવજીનું હેરાસર:—શોઠ નરશી કેશવજીની ધર્મશાળામાં ચૌમુખજીનું લંબ મંદિર છે.

શ્રી નરશી નાથાનું હેરાસર:—શોઠ નરશી નાથાની ધર્મશાળામાં આ હેરાસર છે. ભૂણનાયક શ્રી ચંદ્રપ્રભુજી છે.

મહાવીરસ્વામીનું હેરાસર:—શ્રી વીરખાઈ પાઠશાળાના અંદરના ભાગમાં આ હેરાસર છે.

મોતી સુખીયાનું હેરાસર:—મોતી સુખીયાની ધર્મશાળામાં આ હેરાસર છે.

કંકુખાઈનું હેરાસર:—કંકુખાઈની ધર્મશાળામાં મેડી પર ધર હેરાસર છે.

જશકુવરનું હેરાસર:—જશકુવરની ધર્મશાળાના અંદરના ભાગમાં આ હેરાસર છે.

માધવલાલ બાયુનું હેરાસર:—માધવલાલ બાયુની ધર્મશાળામાં આ હેરાસર છે. ભૂણનાયક તરીકે શ્રી સુમતિનાથ (સાચા દેવ) છે.

પંજાખી ધર્મશાળામાં એક હેરાસર છે.

ઓ જૈન બાલાશ્રમમાં એક હેરાસર છે.

તળેટી નજીક જૈન સોસાયટીમાં રમણીય કાચનું શ્રી વાસુપૂજ્યસ્વામીનું સુંદર હેરાસર છે.

તળેટીમાં આગમમંહિર નામનું લભ્ય દેરાસર છે. સુંદર ચૌમુખલુણી પ્રતિમા છે. મંહિરના વિશાળ ચોકની ઝેરતી હીવાલોમાં આગમો આરસની શિલામાં કોતરીને, કાચથી મઠાવીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. વરચે ચૌમુખ પ્રતિમાણાએ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આગમોદ્ધારક સ્વ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરણાએ આ લભ્ય મંહિરને રમણીય, આકર્ષક અને સ્વચ્છ-સુંદર અનાવવા લગીરથ પુરુષાર્થ કૃયો છે.

શ્રી શત્રુંજયના ઐતિહાસિક ઉદ્ઘારો

તેરમો ઉદ્ઘાર મહુવાના જવડશાએ વિ. સં. ૧૦૮ માં કર્યો હતો. એવી લોકવાયકા છે કે કોઈ ચોગીરાને જવડશાને શત્રુંજયના ઉદ્ઘાર માટે પ્રેરણું કરી હતી. પ્રભાવક શ્રી વજસ્વામીના વરદ હસ્તે જવડશાએ આદીશ્વર લગવાનની લભ્ય પ્રતિમાણી પ્રતિષ્ઠા કરી હતી. પતિ પત્ની જયારે ધવજદંડ ચઢાવવા પ્રાસાદના શિખર પર ચંદ્રા ત્યાં જ પરમાત્માની સ્તુતિ કરતાં કરતાં મૃત્યુ પામ્યા હતા.

ચૌદમો ઉદ્ઘાર કુમારપાળ રાજના સમયમાં સં. ૧૨૧૧ માં ખાહડ મંત્રીએ કર્યો હતો.

ખાહડ મંત્રીના ઉદ્ઘારનો ટૂંક પરિચય

એક વાર ઉદ્યન મંત્રી શ્રી સિદ્ધાચળની યાત્રાએ આવ્યા. ચૈત્યવંદન સમયે તેમણે મુખ્ય મંહિરને જીર્ણ થયેલું જોયું તેથી તેમણે મનથી તીર્થનો ઉદ્ઘાર કરવાનો નિશ્ચય કર્યો. પણ પોતાના જીવન દરમ્યાન તે નિશ્ચયને અમલમાં મૂકી શક્યા નહિં. સંખ્યામાં મૃત્યુ સમયે તેમણે પોતાના પુત્ર

ખાડકને મંહિરનો ઉદ્ઘાર કરવાનો પોતાનો મનસૂણો જણાવ્યો. ખાડકે પોતાના પિતાની ઈચ્છાનુસાર તીર્થનો ઉદ્ઘાર કરવાની તૈયારી કરી. એ વર્ષમાં મંહિર તૈયાર થયું પણ એકાએક સમાચાર આવ્યા કે મંહિરમાં તડ પડી છે. તરતજ ખાડક મંત્રી શત્રુંજ્ય પર આવ્યા અને મંહિરમાં તડ પડવાનું કારણ કારીગરોને પૂછ્યું. તેઓએ જણાવ્યું કે મંહિરની અંદર પ્રદક્ષિણાને માટે જવા આવવાનો જે માર્ગ છે તેમાં હવાના આપટા લાગવાથી મધ્ય લાગમાં ફાટ પડી છે. વળી શિદ્પશાસ્ક પ્રમાણે પ્રદક્ષિણાનો માર્ગ રાખવામાં ન આવે તો મંહિરના નિર્માતાને સંતતિ થાય નહિ એવું વિધાન છે. તરતજ મંત્રીશ્રીએ કહ્યું-સલે, મને સંતતિ ન થાય પણ મંહિરમાં ફાટ પડવી જોઈએ નહિ.

મંત્રીશ્રીના તીર્થપ્રેમને માટે તેમને હજરો વંદન હુલો !

સ. ૧૨૧૧ માં કળિકાળસર્વેશ શ્રી હેમચંદ્રાચાર્યના હસ્તે તેમણે સુખ્ય જૈન મંહિરનો ઉદ્ઘાર કર્યો અને જાવડશાના સમયના પ્રતિમાળને સુખ્ય મંહિરમાં વિરાજમાન કર્યા. ત્યાર પછી સુસલમાનોના અત્યાચારને લીધે સુખ્ય દેરાસરને તુકસાન થતાં અને પ્રતિમાળ ખંડિત થતાં સમરાશાએ સ. ૧૩૭૧ માં નવું મંહિર કરાવ્યું અને નવાં પ્રતિમાળ પદ્ધરાવ્યા અને છેવટે સ. ૧૫૮૭ માં વૈશાખ વહી છઠના દિવસે મેવાડનિવાસી કરમાશા શેડે ગિરિરાજ પર નવું ભવ્ય મંહિર બંધાવી નવા પ્રતિમાળને પદ્ધરાવ્યા છે, જે આજે વિધમાન છે. મૂળનાયકની સામે શ્રી પુંડરીકસ્વામીજીના સુંદર પ્રતિમાળને પણ કરમાશાએ સ. ૧૫૮૭ ની સાલમાં પદ્ધરાવ્યા છે.

નવા આહેશ્વર લગવાનના પ્રતિમાળની વિકભના ૧૬ માસેકમાં સુરતનિવાસી તારાચંદ સંઘવીએ વસ્તુપાલ .તેજ-પાળના મંદિરમાં પ્રતિષ્ઠા કરેલ છે, કારણું કે આ પ્રતિમાળને જૂની દાદાની પ્રતિમાળને સ્થાને પદ્ધરાવવા જતાં અંદરથી “મા મા” એવો ધ્વનિ થયો હતો.

શ્રી શત્રુંજ્યની પાગો

પાગ એટલે પગે ચાલીને શ્રી શત્રુંજ્ય તીર્થ પર જવાનો માર્ગ.

મુખ્ય પાગ:—જ્ય તળાટીથી શરૂ થતાં રસ્તાને મુખ્ય પાગ કહેવામાં આવે છે.

શત્રુંજ્લ નહીની પાગ:—તળેટીના રસ્તા પર શ્રી કલયાણ-વિમળની દેરીની પડખેના રસ્તે થઈ એ ગાઉ હુર શત્રુંજ્લ નહી આવે છે, તેમાં સનાન કરીને આ રસ્તે શત્રુંજ્ય પર ચઢાય છે.

ઘેરીની પાગ:—કુંતાસરના મેદાનની પાસે નવ કુંકના રસ્તે જતાં આ રસ્તો આવે છે. નીચે ઉત્તરતાં એક મંદિર આવે છે, તેને ઘેરીની પાગનું મંદિર કહે છે. ફાગણું શુદ્ધ ૮ ને દિવસે યાત્રાળુંએ ખાસ કરીને ઘેરીની પાગના નીચેના મંદિરના દર્શન કરવા જાય છે, કેમકે લગવાન આદીશ્વર લગવાન આ રસ્તેથી પૂર્વ નવાળું કોડ વાર શ્રી શત્રુંજ્ય પર ચઢાય હતા. એ યાત્રા કરવાના ઈચ્છુક યાત્રાળુંએ દાદાના દર્શન કરી આ પાગની યાત્રા કરે છે.

ધનવસીની ટૂંક :--(ખાંબુનું દેરે)

આ ટૂંકમાં મુખ્ય મંદિરમાં શ્રી આદીશ્વર લગવાનની

ભવ્ય પ્રતિમા છે. ટૂંકની પાસે હાલમાં જવીન જલમંહિર
ખનાવવામાં આવેલ છે. તેમાં શ્રી મહાવીર પરમાત્માની
પ્રતિમા છે.

બાખુના દેરાસરમાંથી ખહાર નીકળતાં પર્વત પરણું
ચઢાણું શરૂ થાય છે. અમુક પગથીઆ ચડતાં પહેલો હુડો
આવે છે. અહીંથી સપાઠ રસ્તો આવે છે અને તેને છેડે
પહેલો કુંડ આવે છે. થોડા પગથિયાં ચડયા પછી ણિને
હુડો (વિસામો) આવે છે. પાસે “કુમાર કુંડ” આવેલો
છે. ત્યાંથી આગળ ચડતાં હીંગલાજનો હુડો આવે છે. ત્યાં
હીંગલાજ માતાજી પાસે એઠેલા ખારેટનો નીચે પ્રમાણે હુંડો
થાડે ફૂરથી સંભળાય છે:—

હીંગળાજનો હડો, કડે હાથ દઈ ચડા;
કૂટચો પાપનો ધડો, બાંધ્યો પુન્યનો પડો.

અહીંથી આગળ ચડતાં નાનો માનમોડીઓ આવે છે.
ત્યાંથી આગળ ચડતાં મોટો માનમોડીઓ આવે છે.

અહીંથી થાડે જ ફૂર છાલાકુંડ આવે છે. અહીં પવનની
શીતલ લહેરાભીઓ આવતી હોવાથી યાત્રાળુઓને વિશ્રામ
દેવાનું મન થાય છે.

અહીંથી પશ્ચિમ તરફ “જિનેંડુંક” તરફ જવાય છે.
ત્યાંથી સપાઠ ભૂમિ પર ચાલતાં ચોતરા પર દેરી આવે છે. આ
દેરીમાં દ્રાવિડ, વારિખિદ્વારા, અધિસુતો અને નારદજીની ચાર
મૂર્તિઓ કાઉસસગ ડ્યાનુથી ઉલેલી છે. કાર્તિકી પુનમનો મહિમા
આ દેરીને લીધે છે. આગળ જતાં ચોયો અને પાંચમો કુંડ
આવે છે. આગળ જતાં હનુમાન ધાર આવે છે. આ સ્થાન

વિશ્રાંતિ માટે સુંદર છે. અહીંથી એ રસ્તા જય છે. એક રસ્તે નવ હુંકમાં જવાય છે અને બીજે રસ્તે દાદાની હુંકમાં જવાય છે. દાદાની હુંકના રસ્તેથી પતિત શેનુંજી નહીં હેખાય છે. આ રસ્તે આગળ વધતાં એક લેખડમાં જાલી, મથાલી અને ઉવયાલી એમ ત્રણું મૂર્તિઓ કેાતરી કાઢેલ છે. થોડે આગળ જતાં રામપોળ આવે છે. અહીં યાત્રાગુઓ પાસેથી લાકડી, છત્રી, મોઝાં વગેરે વસ્તુઓ લઈ લેવામાં આવે છે. પોળની અંદરના ભાગને “હોલા ખાડી” કહે છે. તેમાં સગાળકુંડ આવેલ છે. ત્યાંથી વાધણું પોળમાં (વિમલ-વસહીમાં) જવાય છે. વિમલવસહીમાં હાખલ થતાં ડાખા હાથ પર મુખ્ય મંહિરા નીચે પ્રમાણે છે.

(૧) શ્રી શાંતિનાથજીનું મંહિર.

(૨) ચક્રશરી દેવી.

મૂર્તિ રમણીય અને ચમત્કારી છે. શેઠ કરમાશાંએ સં. ૧૫૮૭ માં શાંતિનાથજીના અધિકારી દેવી શ્રી ચક્રશરી દેવીની સ્થાપના કરેલ છે.

(૩) નેમનાથની ચારી (કળામય મંહિર.)

આ મંહિર વિમલશાહુ મંત્રીએ ખંધાવેલું હોય તેમ લાગે છે. મૂળનાયક શ્રી સુપાર્થનાથ છે.

ખાનુના મંહિસના ધુમટમાં શ્રી નેમનાથજા જીવન-પ્રસંગોના વિવિધ દર્શયો છે.

(૪) સહસ્રણું પાર્થનાથજીનું મંહિર.

(૫) જગતશૈઠનું મંહિર.

(૧) કુમારપ્રાળનું મંદિર.

જમણા હાથ તરફના સુષ્પ મંદિરો:—

(૧) અમીઝરા પાર્વતાથનું મંદિર.

(૨) સમવસરણનું દેરાસર.

(૩) કપડવંજવાળા માણેકખાઈનું દેરાસર.

કુમારપ્રાળ મહારાજાના મંદિર સામે વૃક્ષ નીચે એક પાળીયો છે, તે પાલીતાણાના ભાવસાર જીવાન વિક્રમશીનો છે. તેણે શ્રી શત્રુંજ્ય પર રહેતા અને યાત્રાળુઓને હેરાન કરતા એક વાઘને મારવામાં પોતાના હેહનું બલિદાન આપેલ છે.

વિક્રમશીનો વૃત્તાંત

જીવાન વિક્રમશી ભાઈ અને ભાલી સાથે રહેતો હતો અને કપડાં રંગવાનું કામ કરતો હતો. એક વખત તેને અતિશય ભૂખ લાગી તેથી રસોડામાં ગયો. પણ રસોઈ થવાને થોડીવાર હુતી તેથી ભાલી પર ઝીજાઈ ગયો. તે વખતે ભાલીએ રેખમાં નીચે પ્રમાણે મેણું માર્યું. ઐરી પર શૂર શું બતાવો છો. ખરા હો તો શત્રુંજ્ય પરના વાઘને મારો ને.

ભાસીનું મેણું સાંલળતાં વીર વિક્રમશીને હાડોહાડ રેખ વ્યાપી ગયો. ધરમાં ઝીન્યું હુદ્ધિયાર નહિ હોવાથી માત્ર ધોકો લઈ વાઘને પરાજિત કરવા ધરની બહાર નીકળ્યો. દટ્ઠતા અને નિર્ભયતાથી તે શત્રુંજ્ય ચઢ્યો અને જાડ નીચે રહેતા વાઘને એવા જોરથી ધોકો માર્યો કે તે વાઘ તરમર ખાઈ ગયો. પછી તો બંને વચ્ચે દુંકયુદ્ધ જરૂરું. વિક્રમશીના રક્ષણું માટે માત્ર ધોકો જ હતો. જ્યારે વાઘના વિકરાળ પંજ,

મોતની નિશાની દર્શાવી રહ્યા હતા, છતાં વીર વિક્રમશીએ વાધને ધોકાવડે ખોખરો કરી નાઓ. રોષે ભરાયેલા વાધે વિક્રમશી ઉપર જીવદેણું હુમલો કર્યો. બન્ને જીણું ઐસાન થયા અને મૃત્યુ પામતાં પહેલાં સંકેત પ્રમાણે વિક્રમશીએ જેરથી ઘંટ વગાડ્યો, એટલે વાધણુપોળ પાસે રહેલા લોકોએ જાણ્યું કે વાધ મરાયો છે. આ રીતે વીર વિક્રમશીએ યાત્રાનો માર્ગ ખુલ્લો કર્યો.

સૂર્યકુંડનો પ્રલાવ

સૂર્યકુંડ—હાથીપોળની બાન્ધુમાં એક લાંખી નળીમાં થઈને સૂર્યકુંડ પાસે જવાય છે.

આભાપુરીના રાજ વીરસેનને ચંદ્રકુમાર નામનો પુત્ર હતો પણ અપર માતા વીરમતીએ દ્રેષ્ઠથી તેને કુકડો બનાવી દીધો. ચંદ્રકુમાર (કુકડાના ઝ્યમાં) પોતાની ખીજુ પત્ની સાથે શ્રી શત્રુંજ્યની યાત્રા કરવા આવે છે, કુકડાને એકા-એક પૂર્વ જન્મ યાદ આવ્યો તેથી તે સૂર્યકુંડમાં પડ્યો. તે વખતે તેને ડૂબતો બચાવવા માટે તેની પત્ની પ્રેમલાલબદ્ધી પણ ઝૂંડમાં પડી. કુકડાને પકડવા જતાં અપર માતાએ ખાંધેલો હોરો હાથમાં આવતાં તે અચાનક તૂટી ગયો અને અન્યથી વરચ્ચે કુકડો ફરી વાર ચંદ્રકુમાર સ્વરૂપે પ્રગટ થયો. આ બનાવથી સૂર્યકુંડનો મહિમા ખૂબ વિસ્તર્યો.

શ્રી આદીશ્વર(દાદા)ની દુંક.

મુખ્ય મંદિરને ત્રણું પ્રદક્ષિણા હેવાથી નાના મોટાં ખધાં મંદિરોના અને દેરીઓની પ્રતિમાઓના દર્શન થાય છે.

(૧) સહસ્રકુટનું મંદિર. (૨) રાયણુ પગવાં. (૩) સીમંધર
સ્વામીનું મંદિર. આ મંદિરમાં ભૂગનાયક શ્રી આદીશ્વર
લગવાન છે. (૪) મેરુ શિખર. (૬) સમેતશિખરનું મંદિર.
(૭) પાંચ લાયાનું મંદિર. (૮) ખાજરીયાનું મંદિર. (૯)
વીશ વિહુરમાનનું મંદિર. (૧૦) અણાપણનું મંદિર.
(૧૧) ગંધારીયાનું મંદિર. (૧૨) પુંડરીકસ્વામીનું મંદિર.

દાદાના દર્શન કરતાં હૃદય નાચી ઉઠે છે. જગતના
ત્રિવિધ હુઃખો ભૂલી જવાય છે. વળી સ્વાસ્થાવિક સહજ
આનંદ ઉત્પન્ન થાય છે કે જેથી જિનાલયની ખણાર નીકળવાનું
મન થતું નથી. વળી દાદાની મૂર્તિ સામે નજર રાખી એકી
ટસે દર્શનામૃતનું પાન કરવાનું મન થાય છે. દાદાના દર્શન
કરતી વખતે નીચેના ઉદ્ગગારે યાત્રિકોના હૃદયમાંથી એકા-
એક પ્રગટી નીકળે છે—


સમકિતદ્વાર ગલારે પેસતાંજ,

પાપ-પથલ ગયાં હૂર રે;

મોહન મરુદેવીનો લાડલોજ,

દીઠો મીઠો આનંદપૂર રે.

સમકિતદ્વાર ગલારે પેસતાંજ.



નવ દુંકઃ—

હનુમાન ધાર પાસેથી નવદુંકનો રસ્તો જુદો પડે છે. સૌથી પહેલાં અંગારશા પીરની કખર આવે છે. તીર્થની રક્ષા અર્થે આ કખર કરવામાં આવી હોય તેવી કોણાક્તિ છે.

નરશી કેશવજીની પ્રથમ દુંક [૧]

ચૌમુખજીની બીજુ દુંકમાં જતાં પહેલાં શરૂઆતમાં નરશી કેશવજીની દુંક આવે છે. મૂળનાયક શ્રી અલિનંદન-સ્વામી છે. પ્રતિષ્ઠા સં. ૧૬૨૧ માં કરવામાં આવી હતી પણ સુઝૂર્ત બરાબર ન હોવાથી યાત્રાળુઓમાં તેમજ ગામમાં વ્યાધિ ફેલાતાં ઘણું ભરણું પામ્યા હતા. શાખાને ખાળવા માટે સરપણું ખૂટી પડયું હતું.

આ દુંકના મુખ્ય દેરાસરો નીચે પ્રમાણે છે—

- (૧) શાંતિનાથજીનું મંદિર.
- (૨) મરુદેવી માતાનું મંદિર.

ચૌમુખજીની દુંક યા સવાસેમાની દુંક [૨]

આ દુંકના મધ્યલાગમાં ચૌમુખજીનો વિશાળ પ્રાસાદ છૈ, જેની લંબાઈ ૬૨ ફૂટ, પહેણાઈ ૫૭ ફૂટ અને શિખર ૬૭ ફૂટ જાયું છે. મુખ્ય મંદિરની લંબયતા અનુપમ છે. મંદિરના રંગમંડપના બાર થાંલલા પર ચોવીશ દેવીઓના મનોહર ચિત્રો છે. વાહુનો સહિત કલામય રીતે દેવીઓએ આલેખાયેલી છે. આ દુંક પર્વતના જિચામાં જિચા લાગ પર છે તેથી પચીશ ત્રીશ માઈલ પરથી ચૌમુખજીનું ઉત્તુંગ શિખર નજરે પડે છે.

આ ભીજું જિનપ્રાસાદ કેવી રીતે બનાવવામાં આવ્યો તેની હકીકત જાણવા ચોણ્ય હોઈ અહીં રજૂ કરવામાં આવે છે.

સવાસોમાની કથા

એક વખતે વણુથલીના સવચંદ શોઠ પાસે એક ગરાસદારે પોતે થાપણું મૂકેલા લાખ બાબાશાહી ઝા. માણ્યા પણ શોઠની પેઢીમાં તે સમયે તેટલા ઝૂપિયા ન હતા તેથી અમદાવાદના પ્રતિષ્ઠિત શોઠ સોમચંદ પર, જો કે તેની પાસે પોતાના ઝૂપિયા લેણું ન હતા તો પણ સવચંદ શોઠે હુંડી લખી. હુંડી લખતાં લખતાં આંસુનાં એ ટીપા હુંડી પર પડ્યા. હુંડી લઈ ગરાસદાર અમદાવાદ ગયો અને સોમચંદ શોઠના મુખ્ય સુનીમને મળ્યો. સુનીમે ચોપડાં જેણા પણ સવચંદ શોઠના જમેઝા. નીકળ્યા નહિ તેથી ગરાસદારને શોઠ આવે ત્યારે હુંડી લઈને આવવા કહ્યું. સોમચંદ શોઠ હુંડી વાંચતાં વાંચતાં આંસુનાં ટીપાના ડાધથી વસ્તુસ્થિતિ સમજ ગયા તેથી શોઠે સુનીમને કહ્યું કે-મારે ખાતે લખીને હુંડી સ્વીકારી હ્યો.

થોડા વખત પછી સવચંદ શોઠ બ્યાજ સહિત લાખ ઝા. લઈ સોમચંદ શોઠ પાસે આવ્યા. અને અગાઉ પોતે લખેલ હુંડીની વાત કરી પણ સોમચંદ શોઠે કહ્યું કે તે ઝા. નો જમે ખર્ચ ન ખાઈ ગયો હોવાથી લઈશ નહિ. સવચંદ શોઠે કહ્યું કે હું ઝા. આખ્યા વિના જઈશ નહિ. છેવટે બંનેએ શ્રી શાનુંજય પર હુંક બંધાવવાનો વિચાર કર્યો. આ હુંક સવાસોમળની હુંકને નામે પ્રખ્યાત છે.

છીપાવસી [૩]

આ હુંક ઘણી નાની છે. આ હુંક સં. ૧૯૭૧ માં લાવસાર (છીપા) ભાઈઓએ બંધાવી છે.

શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની ચમત્કારિક દેરીઓ આ ટુંકમાં આવેલી છે. લોકમાન્યતા છે કે આ ખંને દેરીઓ સામસામે હતી. નંદિષેણુસૂરી મહારાજે ચૈત્યવંદન કરતાં એક ખીજુ દેરીને પૂંડ પડતી હોવાના કારણે અજિતશાંતિ સ્તવન અનાંયું. તે પૂર્ણ થતાં ખંને દેરીઓ જેડાંજેડ થઈ ગઈ છે.

સાકરવસી [૪]

મૂળનાયક ચિંતામણી પાર્શ્વનાથ છે. આ ટુંકમાં પાંડવાનું મંહિર છે.

ઉજમબાઈની ટુંક નંદીશ્વરક્ષીપ [૫]

આ ટુંકમાં નંદીશ્વરક્ષીપની મનોહર રચના છે.

હીમવસી [૬]

હેમાભાઈ શેઠ આ ટુંક ખંધાવેલી છે. મુખ્ય મંહિરમાં મૂળનાયક તરીકે શ્રી અજિતનાથ લગવાન છે.

પ્રેમવસી [૭]

શેડ પ્રેમાભાઈએ આ ટુંક ખંધાવેલી છે. મુખ્ય મંહિરમાં મૂળનાયક ઋષલહેવ લગવાન છે.

આ ટુંકમાં સહસ્રાણ્ણા પાર્શ્વનાથનું મંહિર છે. આ મંહિરમાં આરસની સુંદર કારીગરીવાળા બે જોખલા છે.

મોહીની ટુંક પાસેથી આશરે પોણ્ણોસે પગથીયાં ઉત્તરતાં શ્રી આદિનાથ લગવાનના મંહિરમાં જવાય છે. આ પ્રતિમા કુંગરમાંથી કોતરી કાઢેલી છે તેથી ખહુ જ મોટી અને

અદ્ભુત છે. આ મૂર્તિની ઊચોઈ ૧૮ કૂટ છે અને પહોળાઈ ૧૪કું કૂટ છે. અહીં એક નોની દેરીમાં શાંતિનાથની ર્યામ મૂર્તિ છે.

આલાવસી [૮]

આ દુંક ઘોધાવાળા શોઠ દીપચંદ કદ્યાણુલુએ બંધાવેલ છે. તેમનું હુલામણું નામ આલાલાઈ હતું તેથી આ દુંકને “આલાવસી” કહે છે. મુખ્ય મંદિરમાં મૂળનાયક ઋષભદેવ લગવાન છે.

મોતીશા શોઠની દુંક [૯]

વિડેના ઓગણીસમાં સૈકામાં જૈન સમાજમાં જે વે દાનવીર શ્રાવકો થયાં હતા તેમાં સુરતનિવાસી મોતીશા શોઠનું નામ મુખ્ય છે. શ્રી આદીશર લગવાનની મોતી દુંક અને હેમવસહી દુંકની વચ્ચે “કુતાસર” નામની મોતી ખીણું હતો તે ખીણુને લાઘેના ખર્ચે પુરાવીને તેના પર દેવવિમાન જેવી સુંદર દુંક મોતીશા શોઠે બંધાવી છે. આ દુંકની વચ્ચે ગ્રણું માળનું રમણીય મુખ્ય મંદિર છે. આ મંદિરનું ખાતમુહૂર્ત વિ. સં. ૧૮૮૨ માં થયું હતું. મોતીશા શોઠની લાવના પોતાના શુલ હસ્તે ગ્રલુલની પ્રતિષ્ઠા કરવાની હતી પણ લવિતંયતા ખળવાન હોવાથી તે ખન્યું નહિ કારણું કે શોઠ સ્વર્ગવાસ પાણ્યા ત્યાર પછી તેમના સુપુત્ર શોઠ ખીમચંદલાઈએ સુરતથી સંધ કાઢી સં. ૧૮૬૩ ના મહા વહ ખીજના શુલ દ્વિસે મૂળનાયક શ્રી આદીશર લગવાનની પ્રતિષ્ઠા કરેલ છે. મુખ્ય મંદિરની આસપાસ સેણ મંદિરો છે અને મુખ્ય મંદિરની ભમતિમાં એક સો ત્રેવીશ

હેરીઓ છે. દાદાની કુંકમાં જવાની ખારીમાં મહાપ્રભાવ-શાળી મૂળાચંદળ મહારાજની મૂર્તિ એસારેદી છે. આ કુંકની સ્વરચ્છતા અને આકર્ષકતા નજરે નિહાળીને ઘડીલર તેઓ સુગ્રથ થઈ જવાય છે.

પ્રદક્ષિણા

દોઢ ગાઉની પ્રદક્ષિણા

રામપોળની ખારીથી બહારના ભાગમાં કિદ્વાની આઙ્ગુ-ખાંગુ રસ્તે કુરતાં કુરતાં નવ કુંક કુરીને હતુમાનધાર આવી દાદાની કુંકમાં જઈ દર્શાન કરવાથી દોઢ ગાઉની આ પ્રદક્ષિણા પૂરી થાય છે.

૭ ગાઉની પ્રદક્ષિણા

રામપોળની ખારી પાસેથી ૭ ગાઉની પ્રદક્ષિણાનેં રસ્તો જાય છે. આગળ જતાં ઉલકા જલ નામે પોલાણુ આવે છે. દાદાનું નમણું અહીં જમીનમાંથી આવતું હતું એમ મનાય છે.

ચિદ્દાનંદ તલાવડી

શ્રી મહાવીરસ્વામીનાં ગણુધર શ્રી સુધર્માસ્વામીના તપસ્વી શિષ્ય શ્રી ચિદ્દાનંદમુનિ એક મોટા સંઘ સાથે શ્રી શત્રુંજ્ય પર આવતા હતા. સધના મનુષ્યોને બહુ જ તૃપ્તા લાગી હતી તેથી તેમની તૃપ્તાને શાંત કરવા માટે મુનિ મહારાજે પોતાના તપની લાલ્ભિધથી વિશાળ તળાવ પાણીથી ભરી હીથું. સંઘે પાણી પીને તૃપ્તા શાંત કરી. અહીં એ હેરીઓમાં શ્રી અજિતનાથ અને શાંતિનાથની પાદુકા છે. અહીં યાત્રાળુઓ યથાશક્તિ કાઉસંગ કરે છે.

ભાડવાનો કુંગર

ઇ ગાઉની પ્રદક્ષિણાનો મહિમા આ કુંગરને આલારી છે.

સિદ્ધવડ-અહીં અસંઘ્ય મુનિરાજે સિદ્ધિપદને પામ્યા હોવાથી “સિદ્ધવડ” કહેવાય છે. અહીં આહિનાથ લગવાનની પાહુકા છે.

આર ગાઉની પ્રદક્ષિણા

કદંખગિરિ:-આ પર્વત પર ગાઈ ચોવીશીના ખીલ તીર્થું કર નિરવાણી જિને શરના કદંખ નામે ગણુધર એક કોડ મુનિરાજે સાથે મોક્ષ ગયા છે.

હુસ્તગિરિ-કદંખગિરિથી એક ગાઉ હુર ચોક ગામને પાદર શ્રી શેતુંજી નદી ઓળંગાને આ ટેકરી પર જવાય છે.

યાત્રાના મુખ્ય દિવસો

કાર્તિક શુદ્ધ પૂનમઃ—શ્રી ઋષલહેવળુના પૈત્ર દ્રાવિડ વારિભિલ્ય, અદ્યમુત્તા અને નારદજી છ કરોડ મુનિવરે સાથે આ દિવસે સિદ્ધિપદને પામ્યા છે. આ ચાર મહાતપસ્વીઓની સૂર્તિઓ શત્રુંજ્ય પર જતાં હીરણાઈ કુંડની પાસે એક હેરીમાં છે.

ક્રાગણ શુદ્ધ તેરસઃ—શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્રો સાંખ અને પ્રધુમ્બ સાડી આડ કોડ મુનિવરે સાથે ભાડવા કુંગર પર આ દિવસે સિદ્ધિપદને પામ્યા છે.

ચૈત્ર શુદ્ધ પૂનમઃ—શ્રી પુંડરીક ગણુધર પાંચ કોડ મુનિવરે સાથે આ દિવસે મુક્તિપદને પામ્યા છે.

વૈશાખ શુદ્ધ તૃદિંબિકા:-શ્રી ઋષલહેવ લગવાનને અક્ષયતૃતીયા-

ને દિવસે વરસીતપનું પારણું શ્રેયાંસકુમારના હસ્તે શેરડીના રસવડે આ દિવસે થયું હતું.

પૂજય મુનિમહારાજાઓએ તીર્થધિરાજ શત્રુંજયને અનુલક્ષીને ધણ્ણા સ્તવનો ખનાવ્યા છે તેમાંનાં થોડા મુનિમહારાજાઓની કડીઓ વાનગીઝે અડીં પીરસવામાં આવે છે.

શ્રી જ્ઞાનવિજયજી મહારાજાઃ—

ચતુરાધ શું ચિતમાં ચેની, હાથે તે સાથે;
મરણ તણ્ણા નિશાનો મોટાં, ગાજે છે માથે;
ચાલોને પ્રીતમજી ઘારા, સિદ્ધાચળ જધાયે.

શ્રી જ્ઞસવિજયજી મહારાજાઃ—

કોઈ અનેરું જગ નહિ, એ તીરથ તે લે;
એમ શ્રીમુખ હરિ આગળે, શ્રી સીમંધર એલે.
વિમલાચલ નિતુ વંદિયે.

શ્રી પદ્મવિજયજી મહારાજાઃ—

કલિકણે એ તીરથ મોટું, પ્રભુણુ જેમ ભર દરિએ;
વિમળગિરિ યાત્રા નવાણું કરીયે.

શ્રી જ્ઞાનવિમલજી મહારાજાઃ—

ઇણ ગિરિ આવ્યા રે, જિનધર ગણંદરાયે;
સિદ્ધા સાંધુ અનંત,
કઠણુ કરમ એ ગિરિ કરસતાં એ, હોવે કરમ નિશાંત.
માસું મન માણું રે શ્રી સિદ્ધાચળે રે.

પવિત્ર ગિરિરાજના માહાત્મ્યને વર્ણવતાં અનેક થંશો લખાયા છે. તેમાં પૂજયશ્રી ધનેશ્વરસૂરિજીએ રચેતા “શત્રુંજય માહાત્મ્ય” નામના પુસ્તકમાં તીર્થને લગતી અનેક પ્રકારની

હક્કીકતો દર્શાવવામાં આવી છે. તેઓશ્રીએ તે પુસ્તકમાં એક સ્થળે કહેલ છે કે:—

“હે ભાગ્ય જીવો ! ને તમારે આત્મતત્ત્વ જાણવાની છંચા હોય અથવા ધર્મ કરવાની બુદ્ધિ હોય તો બીજું સર્વ છાડી દઈ આ સિદ્ધગિરિનો આશ્રય કરો. શત્રું જયગિરિ પર જઈને સર્વ જગતને સુખના કારણું જિનેશ્વરનું ધ્યાન કરવું શ્રેષ્ઠ છે કેમકે તેના જેવું બીજું પરમ તીર્થ નથી અને જિનધ્યાન વેવો બીજે શ્રેષ્ઠ ધર્મ નથી. પ્રાણી-ઓએ કુલેશ્યાઓથી આપત્તિને આપનારું મન, વચન અને કાયાવડે વેલયંકર પાપ ઉપાર્જન કરેલું હોય છે તે પાપ પણ પુંડરીકગિરિના સમરણુથી અને સ્પર્શનથી નાશ ખાભી જાય છે.

કુલેશ્યા
પુંડરીક

શ્રી સિદ્ધાચલજીનાં ચૈત્યવંદનો

૧

શ્રી શત્રુંજ્ય સિદ્ધક્ષેત્ર સિદ્ધાચલ સાચો;
આદીશ્વર જિનરાયનો, જિહાં મહિમા જાચો ૧
ઇહાં અનંત ગુણવંત સાધુ, પાદ્યા શવવાસ.
એ ગિરિસેવાથી અધિક હોયે લીલ વિલાસ; ૨
કુષ્ટત સવિ ફૂરે હરે એ, બહુ લવ સંચિત જેહ;
સકલ તીરથ શિર સેહરો, દાન નમે ધરી નેહ. ૩

૨

સકલ સુહંકર સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સુણીએ;
સુરનર નરપતિ અસુર ઐચર, નિકરે જે શુણીએ. ૧

સકલ તીરથ અવતાર સાર, ખણુ ગુણગણુ ભંડાર;
પુંડરીક ગણુધર જણ, પાચ્યા લવપાર. ૨
ચૈત્રી પૂનમને દિને એ, કર્મ કરી હૃર;
તે તીરથ આરાહિયે, દાન સુયશ ભરપૂર. ૩

૩

શ્રી શત્રુંજ્ય સિદ્ધક્ષેત્ર, પુંડરિકગિરિ સાચો;
વિમલાચલ ને તીર્થરાજ, જસ મહિમા જાચો. ૧
મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત લણીજે;
મહાપદ્મ ને સહસ્રપત્ર ગિરિરાજ કહીજે. ૨
ઈત્યાદિકખણુ ભાતિશુ એ, નામ જપો નિરધાર;
ધારવિમલ કવિરાજનો શિષ્ય કહે સુખકાર. ૩

શ્રી સિદ્ધાચલજીનું દ૧ નામોવાળું ગૈત્યવંદન (૪)

સિદ્ધા ચ લ શિ અ રે ચઠી, ધ્યાન ધરે જગ્યાશ;
મન વચ્ચ-કાય એકાથશું, નામ જપો એકવીશ. ૧
૧ શત્રુંજ્ય ગિરિ વંદીયે, ૨ બાહુબળી ગુણુધામ;
૩ મર્હેવ ને ૪ પુંડરીકગિરિ, ૫ રૈવતગિરિ વિશ્રામ. ૨
૬ વિમલાચલ ૭ સિદ્ધરાજજી, નામ ૮ લગ્નીરથ સાર;
૯ સિદ્ધક્ષેત્ર ને ૧૦ સહસ્રક્રમલ, ૧૧ મુક્તિનિલય જ્યકાર. ૩
૧૨ સિદ્ધાચલ ૧૩ શતકૂટગિરિ ૧૪ દંક ને ૧૫ કેદિનિવાસ;
૧૬ કુદ્ધાખગિરિ ૧૭ લોહિત્ય નમો, ૧૮ તાલદવજ ૧૯ મુન્યરાશ. ૪
૨૦ મહાણલ ને ૨૧ દદશક્તિ સહી, એમ એકવીશો નામ;
સાતે શુદ્ધિ સમાચારી, કરિયે નિત્ય પ્રણામ. ૫
દંધ શૂન્ય ને અવિધિ દોષ, અતિપરિણુતી જેહ;
ચાર દોષ ૭ દી ભને, લક્ષ્મિલાવ ગુણગોહ. ૬

મનુષ્યજનમ પાભી કરી એ, સદગુરુ તીરથ ચોણ;
શ્રી શુભવી ૨ ને શાસને, શિવરમણી સંચોણ. ૭

શ્રી સિદ્ધાચલજીનાં સ્તવનો

૧ .

શેતુંજગઠના વાસી રે મુજરૈ માનજો રે,
સેવકની સુણી વાતો દિલમાં ધારજો રે;
પ્રભુ મેં દીઠ ડો તુ મ હેઠાર,
આજ મને ઉપન્યો હરખ અપાર
સાહિબની સેવા રે લબ્ધુઃખ લાંગશો રે.
એ આંકળી ૧

અરજ અમારી દિલમાં ધારજ્યો રે,
ચોરાશી લાખ ફેરા રે હૂર નિવારજ્યો રે;
પ્રભુસુને હરગતિ પડતો રાખ, દરિસણુ વહેલું દાખ. સાઠ ર
હોલત સવાઈ રે સેચઠ હેશની રે,
ખતિહારી હું જાઉ તારા વેશની રે:
પ્રભુતારું ઝડું દીઝું ઝ્ય, મોહ્યા સુરનરવુન્દ ને લૂપ. સાઠ ર
તીરથ કો નહિ શતુંજ સરિયું રે,
પ્રવચન ચેખીને ઝીધું મેં પારખું રે;
અધમને જેધ હરખે જેહ, ત્રિલુચન લીલા પામે તેહ. સાઠ ર
સદા તે માણું રે પ્રભુ તાહરી સેવના રે,
ભાવઠ ન આંજો રે જગમાં કે વિના રે;
પ્રભુ માઝરા પહોતા મનના કેઠ
ઇમ કહે ઉદ્ઘરન કહે કર જોહ. સાઠ ર
સાઠ ર

૨

જાતા નવાળું કરીએ વિમલગિરિ, જાતા નવાળું કરીએ.
એ આંકણી.

પૂરવ નવાળુંવાર શેત્રુંજાગિરિ, અષલજિણુંદ સમોસરીએ.
વિમલ જાં ૧

કોડી સહસ ભવ પાતક ત્રૂટે, શત્રુંજય સામે ડગ ભરીએ.
વિમલ જાં ૨

સાત છકુ હોય અહૃમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીએ.
વિમલ જાં ૩

સુંડરીક પદ જાપીએ મન હરાએ, અધ્યવસાય શુલ ધરીએ.
વિમલ જાં ૪

પાપી અલબ્ય ન નજરે હેએ, હિંસક પણુ ઉધરીએ.
વિમલ જાં ૫

ભૂમિસંથારો ને નારીતણો સંગ, દૂરથકી પરિહરીએ.
વિમલ જાં ૬

સચિતપરિહારી ને એકલઆહારી, શુલ સાથે પદ ચરીએ.
વિમલ જાં ૭

પદિક્કમણું હોય વિધિશું કરીએ, પાપ પડલ વિખરીએ.
વિમલ જાં ૮

કલિકાલે એ તીરથ મહોદું, પ્રવહણ જિમ ભર દરિયે.
વિમલ જાં ૯

ઉત્તમ એ ગિરિવર સેવતાં, પદ્મ કહે ભવ તરીયે.
વિમલ જાં ૧૦

૩

વિમલાચલ વિમલા પાણી, શીતલ તરુ છાયા દરાણી;
રસવેધક કંચન ખાણી, કહે દ્વાર સુણો દીક્રાણી.
સનેહી સંત એ ગિરિ સેવો, ચૌદ્ધેન્નમાં તીરય નહીં એવો. ૧

ખૂબ રી પાળી ઉડલસીએ, જીદું અહેમ કાયા કસીએ;
મોહ મદ્વાની સામા ધસીએ. વિમલાચલ વેગે વસીએ.
સનેહી૦ ૨

અન્ય સ્થાનક કર્મ લે કરીએ, તે હિમગિરિ છેદ હરીએ;
પાછળ પ્રદિક્ષણું ફરીએ, ભવજલનિધિ વહેલા તરીએ.
સનેહી૦ ૩

શિવમંદિર ચઠવા કાજે, સોયાનની પંક્તિ બિરાજે;
ચઠતાં સમકિતી છાજે, હુરભવ્ય અભવ્ય તે લાજે.
સનેહી૦ ૪

પાંડવ પમુહા કેઇ સંતા, આદીશર ધ્યાન ધરંતા;-
પરમાત્મ ભાવ ભજંતાં, સિદ્ધાચલ ભિદ્યા અનંતા.
સનેહી૦ ૫

ખૂબ માસી ધ્યાન ધરાવે, શુક્રરાજ તે રાજ્યને પાવે;
ખહિરંતર શત્રુ હરાવે, શત્રુંજય નામ ધરાવે.
સનેહી૦ ૬

પ્રશ્નિધ્યાને લને ગિરિ જાચો, તીર્થાંકર નામ નિકાચો;
મોહરાયને લાગે તમાચો, શુઅવીર વિમલગિરિ સાચો.
સનેહી૦ ૭

રાયણ પગલાંનું સ્તવન

નીલુડી રાયણ તરુ તળે સુણુ સુંદરી,
 પીલુડા પ્રભુજીના પાય રે ગુણમંજરી.
 ઊજજવલ ધ્યાને ધ્યાધિએ સુણુસુંદરી,
 એહી જ મુક્તિ ઉપાય રે ગુણ મંજરી. ૧

શીતલ છાયાએ એસીએ સુણુ સુંદરી,
 રાતડો કરી મન રંગ રે ગુણમંજરી.
 પૂજાએ સોવન કૂલડે સુણુ સુંદરી;
 જેમ હોય પાવન અંગ રે ગુણમંજરી. ૨

ખીર જરે જેહ ઉપરે સુણુ સુંદરી,
 નેહ ધરીને એહ રે ગુણ મંજરી;
 ત્રીને લવે તે શિવ લહે સુણુ સુંદરી;
 થાયે નિર્મલ હેહ રે ગુણમંજરી. ૩

પ્રીત ધરી પ્રદક્ષિણા સુણુ સુંદરી.
 દીએ એહને જે સાર રે ગુણમંજરી;
 અલંગ પ્રીતિ હોય જેહને સુણુ સુંદરી,
 લવ લવ તુમ આધાર રે ગુણમંજરી. ૪

કુસુમ પત્ર કુલ મંજરી સુણુ સુંદરી,
 શાખા થડ ને મૂલ રે ગુણમંજરી;
 હેવતણા વાસા અછે સુણુ સુંદરી,
 તીરથને અનુકૂલ રે ગુણમંજરી. ૫

તીરથ ધ્યાન ધરો મુદા સુણુ સુંદરી,
 સેવો એહની છાંય રે ગુણમંજરી;
 શાનવિમલ ગુણ લાભિયો સુણુ સુંદરી,
 શતુંજયમાહાત્મ્યમાંહી રે ગુણમંજરી. ૬

શ્રી પુંડરીકગિરિ-સ્તવન

વીરજી આવ્યા રે વિમલાચલકે મેદાન

સુરપતિ પાયા રે સમવસરણુ કે મંડાણુ—એ આંકળી
હેશના હેવે વીરજી સ્વામ, શત્રુંભ્રય મહિમા વરણુવે તામ;
પુંડરીકગિરિ અલિધાન, સોહમ ઈદ્દો રે; તવ પૂછે બહુ માન;
કિમ થયું સ્વામી રે, લાખો તાસ નિદાન. વીરજી૦ ૧

પ્રભુજી લાવી સાંલળ ઈદ, પ્રથમ જે હુવા ઋષલજિણુંદ;
તેહના પુત્ર તે ભરત નરિંદ, ભરતના હુવા રે ઋષલસેન
પુંડરીક; ઋષલજી પાસે રે, હેશના સુણી તહકીક,
દીક્ષા લીધી રે, ત્રિપદી જ્ઞાન અધિક. વીરજી૦ ૨

ગણુધર પદવી પામ્યા જમ, દ્વારશાંગી ગુંથી અભિરામ;
વિચરે મહિયલમાં ગુણુધામ, અનુક્રમે આવ્યા રે;
શ્રી સિદ્ધાચલ ઢામ, સુનિવર કોડી રે;
પંચતણે પરિવાર અણુસણુ કીધા રે; નિજ આતમને ઉદ્ધાર.

વીરજી૦ ૩

તૈત્રી પૂનમ દિવસે એહ, પામ્યા કેવલજ્ઞાન અછેહ;
શિવસુખ વરીયા અમર અદેહ, પૂણુંનંદીરે અશુદ્ધલઘુ અવગાહ;
અજ અવિનાશી રે, નિજ ગુણુલોગી અખાહ;
નિજ ગુણ ધરતા રે, પરપુદ્ગલ નહીં ચાહ.

વીરજી૦ ૪

તેજુ પ્રગટયું પુંડરગિરિનામ, સાંલળસોહમ હેવલોક સ્વામ;
એહનો મહિમા અતિહિ ઉદામ, તેણે દિન કીજે રે;
તપ જ્યે પૂજા ને ઢાન, પ્રત વળી પોસહ રે;
દેહ કરે અનિદાન, ક્રણ તસ પામે રે, પંચકોડી ગુણું માન

વીરજી૦ ૫

અક્તે લખ્ય જીવ ને હોય, પંચમ લવે સુક્તિ લહે સોય;
તેહમાં ખાપક છે નહિ કોય, વ્યવહાર-કેરી રે;
મધ્યમ કૃળની એ વાત, ઉત્કૃષ્ટ ચોગેરે, અંતરમુહૂર્ત વિખ્યાત;
શિવસુખ સાથે રે, નિજ આતમ અવહાત.

વીરળો ૬

ચૈત્રી પૂનમ મહિમા દેખ, પૂજા પંચ પ્રકારી વિશેષ;
તેહમાં નહિ ઉણીમ કાંઈ રેખ, એણી પેરે લાખી રે;
જિનવર ઉત્તમ વાણુ, સાંલળી ખૂઝયા રે;
કેદક લવિક સુજાણુ, એણી પરે ગાયો રે, પદ્મવિજય સુપ્રમાણુ

વીરળો ૭

[૨]

એક દિન પુંડરીક ગણુધરુ રે લાલ,
પૂછે શ્રી આદિજિણુંદ સુખકારી રે;
કહીએ તે લવ જલ ઉતરી રે લાલ,
પામીશ પરમાનંદ લવ વારી રે. એક૦ ૧

કહે જિન ઈણુ ગિરિ પામશો રે લાલ,
જાન અને નિરવાણુ જથકારી રે;
તીરથ મહિમા વાધશો રે લાલ,
અધિક અધિક મંડાણુ નિરધારી રે. એક૦ ૨

ઇમ નિસુણીને ઈહાં આવીયા રે લાલ,
ધાતી કરમ કર્યાં ફર તમ વારી રે:
પંચ કોડ મુનિ પરિવર્યા રે લાલ,
હુઅા ચિંહિ હજૂર લવ વારી રે. એક૦ ૩

એત્રી પૂનમ દિને કીજુયે રે લાલ,
પૂજા વિવિધ પ્રકાર દ્વિલ ધારી રે;
કુળ પ્રદક્ષિણા કાઉસગ્ગા રે લાલ,
લોગરસ્સ થુદી નમુઞ્ચાર નરનારી રે.

એક૦ ૪

દશ વીશ ત્રીશ ચાલીશ લક્ષાં રે લાલ,
પચાસ પુષ્પની માળ અતિ સારી રે;
નરભવ લાહો લીજુયે રે લાલ,
જેમ હોય જાન વિશાલ મનોહારી રે.

એક૦ ૫

શ્રી સિદ્ધાચલજીનું સ્તવન

મારું મન મોહું રે શ્રી સિદ્ધાચલે રે,
હેખીને હરભિત થાય;
વિધિશું કીજે રે જાગ્રા એહની રે,
ભવલવનાં દુઃખ જાય. મારું ૧

પાંચમે આરે રે પાવન કારણું રે,
એ સમો તીરથ ન કોય;
મીઠો મહિમા રે, જગમાં એહનો રૈ;
આ ભરતે ઈંડાં જોય. મારું ૨

ઈણુ ગિરિ આવ્યા રે જિનવર ગણુધરા રે,
સિદ્ધયા સાધુ અનંત;
કટિણુ કરમ પણ એ ગિરિ ઝરસતા રે,
હોવે કરમ નિશાંત. મારું ૩

જૈન ધરમને સાચો જાહીયે રે,
માનવ તીરથ એ સ્તંભ;

સુર નર કિન્જર નૃપ વિધાધરા રે,
કરતાં નાટારંભ. મારું ૪

ધન્ય ધન્ય દહાડો રે ધન્ય વેલા ધડી રે,
ધરીએ હૃદ્ય મોઝાર;
જાનવિમલસૂરિ શુણુ એહના ધણ્યા રે,
કહેતા નાવે હો પાર. મારું ૫

શ્રી આદિજિનેશ્વર--વિનિતિનું સ્તવન

સુષુ જિનવર શોતુંઝ ધણીઅ. દાસ તણી અરદાસ,
હુજ આગળ બાળક પરેણ, હું તો કરું વેખાસ રે
જિનળુ મુજ પાપીને રે તાર.
હું તો કરુણા રસ લયીઅ, હું સહુનો હિતકાર રે.
જિનળુ મુજુ ૧

હું અવગુણ્યનો એારડોઅ, ગુણુ તો નહીં લવદેશા;
પરગુણુ ચેખી નહિ શકુંઅ, કેમ સંસાર તરેશ ?
જિનળુ મુજુ ૨

જીવતણુા વધ મેં કર્યાંઅ, ઓદ્યા મૃષાવાદ;
કપટ કરી પરધન હ્યાંઅ, સેવ્યા વિષય સંવાદ રે.
જિનળુ મુજુ ૩

હું લંપટ હું લાલચુંઅ, કેમ કીધાં કેદ કોડ;
ત્રણ ભુવનમાં કો નહીંઅ, જે આવે મુજ નેડ રે.
જિનળુ મુજુ ૪

છદ્ર પરાયાં અહેનિશેણ, જેતો રહું જગનાથ !
કુગતિતણી કરણી કરીઅ, જેડયો તેહણું સાથ રે.
જિનળુ મુજુ ૫

કુમતિ કુટિલ કદાચહીલ, વાંકી ગતિ મતિ સુજ;
વાંકી કરણી માહરીલ, શી સંભળાવું તુજ રે?

જિનલુ સુજો ૬

પુન્ય વિના સુજ પ્રાણિઓલ, જણે મેલું રે આથ;
તૌચા તરુવર મોરીયાંલ, ત્યાંહી પસારે હુથ રે.

જિનલુ સુજો ૭

વિષુ ખાધા વિષુ લોગવ્યાલ, ફેઅટ કર્મ બંધાય;
આર્ત દ્યાન મીટે નહીંલ, કીને કવણુ ઉપાય રે.

જિનલુ સુજો ૮

કાજળથી પણ શામળાલ, મારા મન-પરિણામ;
સોણામાંહી તાહરુંલ, સંભારું નહીં નામ રે.

જિનલુ સુજો ૯

મુહુધ લોક ઠગવા લણીલ, કરું અનેક પ્રપંચ;
કુડ કપ્ત બહુ કેળવીલ, પાપ તણો કરું સંચ રે.

જિનલુ સુજો ૧૦

મન ચંચળ ન રહે કિમેલ, રાચે રમણી રે ઝૃપ;
કામ વિટાણુા શી કહુંલ, પડીશ હું હુર્ગતિ કૂપ રે.

જિનલુ સુજો ૧૧

કિશ્યા કહું ગુણુ માહરાલ, કિશ્યા કહું અપવાદ;
નેમ નેમ સંભારું હિયેલ, તેમ તેમ વધે વિખવાદ રે.

જિનલુ સુજો ૧૨

ગિરુઓ તે નવિ લેખવેલ, નિગુણ સેવકની વાત;
નીચતણે પણ મંદિરેલ, ચંદ્ર ન ઢાળે જયેત રે.

જિનલુ સુજો ૧૩

!

નિગુણો તો પણ તાહરોળ, નામ ધરાવ્યું દાસ;
કૃપા કરી સંભાળનેળ, પૂરને મુજ મન આશ રે.

જિનળ મુજો ૧૪

પાપી જણું મુજ લણુંલ, મત મૂકો રે વિસાર;
વિષ હુળાહળ આદર્થોળ, ઈશ્વર ન તને તાસ રે.

જિનળ મુજો ૧૫

ઉત્તમ ગુણુકારી હુંએળ, સ્વાથ્ વિના સુણણ;
કરસણ સિંચે સર લરેળ, મેહ ન માગે દાણ રે.

જિનળ મુજો ૧૬

તું ઉપકારી ગુણુનીલોળ, તું સેવક પ્રતિપાણ;
તું સમરથ સુખ પૂરવાળ, કર માહરી સંભાળ રે.


જિનળ મુજો ૧૭

તુજને શું કહીએ ધણુંલ, તું સહુ વાતે રે જાણ;
મુજને છોને સાહિયાળ, ભવ ભવ તાહરી આણ રે.

જિનળ મુજો ૧૮

નામિરાયા કુલ ચંદ્રોળ, મરુદેવીનો નંદ;
કહે જિનહરખ નિવાજનેળ, દેને પરમાનંદ રે.

જિનળ મુજો ૧૯



શ્રી શાનુંજ્યનાં ૨૧ ખમાસમણાં દેવા માટેના
૨૧ નામોના ગુણગલીત દુહા

પહેલા ખમાસમણના દુહા

સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મજાર;

મનુષ્ય જન્મ પામી કરી, વંદું વાર હજાર. ૧

૧.અંગ ૨.વસન ૩.મન ૪.ભૂમિકા, ૫.પૂજનગરણ સાર;

૬.યાયદ્રવ્ય ૭.વિધિશુદ્ધતા શુદ્ધ સાત પ્રકાર. ૨

કાર્તીક સુહિ પૂનમ દિને, દસ કોઠી પરિવાર;

દ્રાવિડ વારિણિલાળ, સિદ્ધ થયા નિરધાર. ૩

તિણે કારણું કાર્તીકી દિને, સંધ સયલ પરિવાર;

આદિજન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪

એકવીશ નામે વરણુંયો, તિહાં પહેલું અભિધાન:

શાનુંજ્ય શુકરાચથી, જનક વચન બહુમાન. ૫

[“ સિદ્ધાચલ સમરું સદા સોરઠ દેશ મજાર;

મનુષ્ય જન્મ પામી કરા, વંદું વાર હજાર. ૧]

આ દુહા પ્રત્યેક ખમાસમણ હીઠ ખમાસમણના દુહા બોસ્યા આદ

બોલવો અને પછી ખમાસમણ દેણું.

ધીજા ખમાસમણના દુહા

સમોસયાં સિદ્ધાચલે, પુંડરીક ગણુધાર;

લાખ સવા માહાતમ કહ્યું, સુર નર સભા મજાર. ૬

૧. શરીરશુદ્ધિ. ૨.વસ્ત્રશુદ્ધિ. ૩.ચિત્તશુદ્ધિ. ૪.ભૂમિશુદ્ધિ. ૫.ઉપકરણું-૦
શુદ્ધિ. ૬. દ્રવ્યશુદ્ધિ. ૭. યચાર્થવિધિ શુદ્ધિ.

ચૈત્રી પુનમને દિન, કરી અણુસણુ એક માસ;
પાંચકોડિ સુનિ સાથશું, સુક્રિતનિતયમાં વાસ. ૭
તિણે કારણુ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત;
મન વચ્ચ કાચે વદીએ, ઉઠી નિત્ય પ્રભાત. ૮ સિદ્ધાં

ત્રીજા ખમાસમણુના દુર્લા

વીશ કોડીશું પાંડવા, મોક્ષ ગયા ઈણે ઠામ;
એમ અનંત મુક્તે ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ ૯ સિદ્ધાં

ચોભા ખમાસમણુના દુર્લા

અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ધડી એક;
તુંખીજલ સ્નાને કરી, જાગ્રો ચિત્ત વિવેક. ૧૦
ચંદ્રશેખર રાજ પ્રસુખ, કર્મકઠિન મલધામ;
અચલ પદે વિમલા થયા, તિણે વિમલાચલ નામ. ૧૧ સિદ્ધાં

પાંચમા ખમાસમણુના દુર્લા

પર્વતમાં સુરગિરિ વડો, જિન અલિબેક કરાય;
સિદ્ધ હુઆ સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨
લરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમો તીરથ ન એક;
તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. ૧૩ સિદ્ધાં

છઠો ખમાસમણુના દુર્લા

એંસ્તી ચોજન પૃથુલ છે, જીચપણે ચ૦૧૦૧૬;
મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ. ૧૪ સિદ્ધાં

સાતમા ખમાસમણુના દુર્લા

ગંણુધર ગુણુવંતા સુનિ, વિશ્વમાંહે વંદનિક;
નેહુદો તેહુદો સંયમી, વિમલાચલે (એ તીરથે) પૂજનિક. ૧૫

વિપ્રદોક વિષધર સમા, હુઃખ્યિયા ભૂતલ માન;
દ્રવ્યલિંગી કણુ ક્ષેત્ર સમે, મુનિવર છીપ સમાન. ૧૬

શ્રાવક મેઘ સમા કર્યા, કરતા પુષ્ટયનું કામ;
પુષ્ટયની રાશિ વધે ધણી, તિણે પુષ્ટયરાશિ નામ. ૧૭ સિદ્ધા.

આઠમા ખમાસમણુના દુષ્ટા

સંચયમધર મુનિવર ધણ્ણા, તપ્ય તપતા એક ધ્યાન;
કર્મ વિયોગે પામીયા, કેવલ લક્ષ્મીનિધાન. ૧૮

લાખ એકાણું શિવ વર્યા, નારદશું અણુગાર;
નામ નમો તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. ૧૯ સિદ્ધા.

નવમા ખમાસમણુના દુષ્ટા

શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા નિલાસ;
ઇદ્રની આગે વર્ણાંયો, તિણે એ ઇદ્રપ્રકાશ. ૨૦ સિદ્ધા.

દશમા ખમાસમણુના દુષ્ટા

દશકોટી આળુવ્રતધરા, લક્તે જમાડે સાર;
જૈન તીર્થ યાત્રા કરે, લાલતણ્ણા નહીં પાર. ૨૧

તેહ અકી સિદ્ધાચ્યલે, એક મુનિને દાન;
દેતાં લાખ ધણ્ણા હુવે, મહાતીરથ અલિધાન. ૨૨ સિદ્ધા.

અઞ્જિયારમા ખમાસમણુના દુષ્ટા

પ્રાચે એ ગિરિ શાશ્વતો, રહેશે કાલ અનંત;
શત્રુંજય માહાતમ સુણી, નમો શાશ્વતગિરિ સંત. ૨૩ સિદ્ધા.

ભારમા ખમાસમણુના દુષ્ટા

ગૌ નારી બાલક મુનિ, ચઉ હત્યા કરનાર;
યાત્રાં કરતાં કાન્તિંકી, ન રહે પાપ લગાર. ૨૪

જે પરદારા લંપઠી, ચોરીના કરનાર;
દૈવદ્રોધ ગુરુદ્રોધનાં, જે વળી ચોરણોહાર. ૨૫
ચૈત્રી આતિંકી પૂનમે, કરે યાત્રા ઈણે ઠામ;
તપ્ય તપતાં પાતિક ગળે, તિણે દદશક્તિ નામ. ૨૬ સિદ્ધાં

તેરમા ખમાસમણુના દુષ્ટા

ભવ ભય પાર્મી નિકળ્યા, થાવસ્વાસુત જેહ;
સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિવયગિરિ તેહ. ૨૭ સિદ્ધાં

ચૌડમા ખમાસમણુના દુષ્ટા

ચંદા સુરજ બિંદું જણ્ણા, જોમા ઈણે ગિરિ શૂંગ;
વધાવિયો વર્ણુન કરી, (કરી વર્ણવ ને વધાવિયો)

પુણ્યદંતગિરિ રંગ. ૨૮ સિદ્ધાં

પંડરમા ખમાસમણુના દુષ્ટા

કર્મકલણું ભવજલ તળ, ઈણાં પાર્મયા શિવસન્ન;
ગ્રાણી પદ્મ નિરંજની, વંદો ગિરિ મહાપદ્મ. ૨૯ સિદ્ધાં

સોણમા ખમાસમણુના દુષ્ટા

શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચિયો સાર;
સુનિવર વર એઠક ભણી, પુછવીપીઠ મનોહાર. ૩૦ સિદ્ધાં

સત્તારમા ખમાસમણુના દુષ્ટા

શ્રીસુભદ્રગિરિ નમો, લદ તે મંગલ ઝૃપ;
જલ તરુ ૨૪ ગિરિવર તણી, શિષ ચડાવે ભૂપ. ૩૧ સિદ્ધાં

અદારમા ખમાસમણુના દુષ્ટા

વિદ્યાધર સુર અપદ્ધરા, નદી શત્રુંળ વિલાસ;
કરતાં હરતા પાપને, લજુયે લવી કૈલાસ. ૩૨ સિદ્ધાં

એાગળીસમા ખમાસમણુના દુહા।

ધીન નિર્વાણી પ્રભુ, ગર્છ ચોવીશી મોઝાર;
તસ ગણુધર મુનિમાં વડા, નામે કદંબ અણુગાર. ૩૩
પ્રભુ વચ્ચે અણુસન કરી, મુક્તિપુરીમાં વાસ;
નામે કદંબગિરિ નમો, તો હોય લીલ વિલાસ. ૩૪ સિદ્ધાં

વીસમા ખમાસમણુના દુહા।

પાતાલે જસ મૂલ છે, ઉજનવલગિરિનું સાર;
ત્રિકરણુ ચોગે વંદ્તા, અદ્વય હોયે સંસારે. ૩૫ સિદ્ધાં

એકવીસમા ખમાસમણુના દુહા।

તન-મન-ધન સુત વલલસા, સ્વર્ગાર્દિક સુખલોગ;
ને વાંછે તે સંપન્જે, શિવરમણી સંચોગ. ૩૬
વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે બદ્દ માસ;
તેજ અપૂર્વ વિસ્તરે, પૂરૈ (પૂર્ગે) સધળી આશ. ૩૭
ગીને ભવ સિદ્ધિ લહે, એ પણુ પ્રાયિક વાચ;
ઉત્કૃષ્ટા પરિણામથી, અંતરમુહૂરત સાચ. ૩૮
સર્વકામદાચક નમો, નામ કરી ઓળખાણુ;
શ્રી શુભવીરવિજય પ્રભુ, નમતાં કોડ કલ્યાણુ. ૩૯ સિદ્ધાં

કષલદેવસ્વામિની સુતિ

શ્રી સિદ્ધાચલમંડણુ, કષલજિણુંદ દ્વાલ;
મરુહેવાનંદન વંદન કરુ ત્રણ કંલ;
એ તીરથ જણી પૂર્વ નવાણું વાર,
આદીશ્વર આવ્યા જણી લાલ અપાર. ૧

શ્રી ચંદ્રાયન જીમ ગ્રાન્ટલાઇસ
અનુકૂળ



શ્રી શતુંજય સ્તોત્ર	१
મંગળાચારણ પણ-૧	૨
ઉદ્ઘારવણું	૪
પાદીનાથુર્દર્શન	૮
સિદ્ધાચારણર્શન	૧૦
શ્રી આનિનાથ દાશર્થન	૧૪
અન્યાન્ય દ્વંડ વષણું	૧૮
સંધ્વાણ	૨૨
તીર્થ રક્ષણ	૨૬
કળશ	૩૩
એકલીસ ખમાસમણા	૩૪
શતુંજયપદ્માસી	૩૬
તીર્થાધિગ્રહણ સંક્ષિપ્ત વષણું	૪૧

શ્રી સિદ્ધાચારણનાં	
ચૈત્યવંદનો [૪]	૬૦
શ્રી સિદ્ધાચારણનાં સ્તવનો	
શેતુંજણદા વાર્ષિ રે	૬૨
નવા નવાણું કરીયો	૬૩
વિમલાચલ વિમળા પાણી	૬૪
નીલુરી રાયણ તરુ તળે	૬૫
પીરજ આભ્યા રે વિમળાચળે	૬૬
એક લિન પુંડીન પણુંધરુ રે	૬૭
મારું મન મોદ્દુ રે શ્રી સિદ્ધાચલે	૬૮
સુણુ જિનવર શેતુંજણ ધર્યુંઝ	૬૯
શ્રી શતુંજયના એકલીસ ખમા-	
સમણના દૃઢાયો	૭૨
શ્રી અધિબહેવસ્વાગીની રહુતિ	૭૬